

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગરના પત્ર-કમાંક
જીસીઈઆરટી/સી ઓન્ડ ઈ/2014/2222, તા. 3-2-2014-થી મંજૂર

શિક્ષક અને વાતી માટે અલગથી
શિક્ષક-આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે,
જેનો ઉપયોગ અવશ્ય કરશો.

ગાણિત

ઘોરણ 5

(પ્રથમ સત્ર-દ્વિતીય સત્ર)



પ્રતિજ્ઞાપત્ર



ભારત મારો દેશ છે.

બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે.

હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.

હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.

હું મારાં માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જગ્યા સાથે સભ્યતાથી વર્તીશ.

હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક

વિદ્યાર્થીનું નામ: _____

શાળાનું નામ: _____

વર્ગ: _____ રોલ નંબર: _____



ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર-382010

© ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર

આ પાઠ્યપુસ્તકના સર્વ હક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને હસ્તક છે.
આ પાઠ્યપુસ્તકનો કોઈ પણ ભાગ કોઈ પણ રૂપમાં ગુજરાત રાજ્ય શાળા
પાઠ્યપુસ્તક મંડળના નિયામકની લેખિત પરવાનગી વગર પ્રકાશિત કરી શકાશે નહિ.

બેખન-ચંપણ (SRG)

શ્રી રાધાબહેન યાદવ	શ્રી પરિમલ પટેલ
શ્રી સોનુ ગોહેલ	શ્રી સુકેતુ યાંગિક
શ્રી ભરત પ્રજાપતિ	શ્રી સુવિષ્ટ પ્રજાપતિ
શ્રી ચિંતન શાહ	શ્રી જિંશેશ શાહ
શ્રી હિતેશ પ્રજાપતિ	શ્રી ગૌરાંગ પટેલ
શ્રી પ્રતીક પટેલ	શ્રી પ્રકાશ પ્રજાપતિ
શ્રી સંજ્ય પટેલ	શ્રી મૃવ દેસાઈ
શ્રી અશોક પરમાર	શ્રી પંકજાંગ ગોસ્વામી
શ્રી દીપિત ઘોડાસરા	શ્રી કેતન પટેલ
શ્રી પ્રેરેશ ઉપાધ્યા	શ્રી નિલેશ નાથાણી
શ્રી રાજેન્દ્રસિંહ પરમાર	શ્રી ધીરુભાઈ પંચાલ
શ્રી કોમલ જાખુઅવાલા	

સમીક્ષા

શ્રી એમ. એસ. જાજ્જલ	ડૉ. કાનશ્યભાઈ વી. પટેલ
શ્રી બક્સિટભાઈ પી. પટેલ	શ્રી જયકૃષ્ણ એન. બહુ

ભાષાપ્રાર્થિ

શ્રી એ. બી. દાબે

ચિત્રાકાંકન

શ્રી સ્મિતા રાણી	શ્રી કાનશ્યભાઈ પરમાર
શ્રી જયંત પ્રશામી	શ્રી ગૌરીશેંકર મહેતા
શ્રી અંકુર સૂર્યક	શ્રી મનીષ પારેબ

સંયોજન

શ્રી આશિષ એચ. બોરીસાગર
(વિષય-સંયોજક : ગાંધિત)

નિર્માણ-ચાયોજન

શ્રી સી. ડી. પંડ્યા
(નાયબ નિયામક : શૈક્ષણિક)

મુદ્રણ-ચાયોજન

શ્રી હરેશ એસ. લીભાયીયા
(નાયબ નિયામક : ઉત્પાદન)

પ્રસ્તાવના

NCF-2005 તેમજ RTE-2009ને ધ્યાનમાં રાખીને દેશમાં પ્રાથમિક શિક્ષણનાં અભ્યાસક્રમ, પાઠ્યકક્ષ અને પાઠ્યપુસ્તકો તેમજ સમગ્ર શિક્ષણ-પ્રક્રિયામાં બદલાવ થઈ રહ્યો છે. આ બદલાવ મુખ્યત્વે જે-તે વિષયો તેમજ શિક્ષણ-પ્રક્રિયા સંદર્ભે આપણી સમજ અંગેનો છે. બાળકની સર્જનશીલતા, વિચારશક્તિ, તર્કશક્તિ અને પૃથક્કરણ કરવાની આવકાન વિકસને એ આ અભ્યાસક્રમનો મુખ્ય હેતુ છે. આ અભિગમને ધ્યાનમાં રાખીને જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ **પેરફ્ક કન્ટુ ગાંધિત** વિષયનું પ્રસ્તુત પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાદીઓ સમજ રજૂ કરતાં મંડળ આનંદ અનુભવે છે.

નવા અભ્યાસક્રમ, પાઠ્યકક્ષ અને પાઠ્યપુસ્તક-નિર્માણની સમગ્ર પ્રક્રિયામાં IGNUS-erg ટીમના સભ્યોએ સતત ચાર્ગડર્શન આપત્ત રહીને સેટ રિસોર્સ ગ્રૂપના સભ્યોને સજ્જ બનાવ્યા છે. UNICEFનો સહયોગ પણ આ આખી પ્રક્રિયા દરમિયાન મળ્યો છે. જે-તે વિષયના કોર ગ્રૂપના સભ્યોએ પણ વખતોવખત સહયોગ આપ્યો છે.

આ પાઠ્યપુસ્તકનો સમગ્ર રાજ્યભાષાની અમલ કરતાં અગાઉ પસંદગીની શાળાઓમાં ત્રણ વર્ષ માટે અજમાયશી ધોરણે મૂકવામાં આવેલ હતું. તે દરમિયાન વિદ્યાર્થીઓને વર્ગમાં શીખવાડતી વખતે જે-જે અનુભવો થયા તેના વ્યાપક તારણો, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા અને તે મુજબ સુધ્યા-વધારા કરવામાં આવ્યા છે.

આ પાઠ્યપુસ્તકના સમગ્ર રાજ્યવ્યાપી અમલ પૂર્વ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આમંત્રિત વિષય-નિષ્ણાતો અને પાઠ્યપુસ્તક તૈયાર કરનાર જી.સી.ઈ.આર.ટી.ના નિષ્ણાતોની સંયુક્ત બેઠક બોલાવીને તેઓનાં સૂચનોને ધ્યાનમાં લઈને આ પાઠ્યપુસ્તકને અંતિમ સ્વરૂપ આપવામાં આવેલ છે.

આ પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવી છે. તેના ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે હોંશે તેનો ઉપયોગ કરે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ પાઠ્યપુસ્તકને કાર્યરહિત બનાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા છે, તેમ છતાં શિક્ષણમાં સર ધરાવનાર વ્યક્તિઓ પાસેથી સૂચનો આવકાર્ય છે.

એમ. ડી. શાહ

નિયામક
(જી.સી.ઈ.આર.ટી.)

ડૉ. ભરત પટેલ

નિયામક
(પાઠ્યપુસ્તક મંડળ)

ડૉ. નीતિન પણેલી

કાર્યવાહક પ્રમુખ
(પાઠ્યપુસ્તક મંડળ)

તા. 31-1-2014

ગાંધીનગર

પ્રથમ આવૃત્તિ : 2014

પ્રકાશક : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, 'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર વતી

મુદ્રક :



મૂળભૂત ફરજો

ભારતના દરેક નાગરિકની ફરજ નીચે મુજબ રહેશે :*

- (ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
- (ખ) આજાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
- (ગ) ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
- (ઘ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હક્કાલ થતાં, તેમ કરવાની;
- (ચ) ધાર્મિક, ભાષાકીય, ગ્રાદેશિક અથવા સાંપ્રદાયિક લેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુભેળ અને સમાનબંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, સીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજ દેવાની;
- (ઝ) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજ તે જાળવી રાખવાની;
- (ઝા) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકૂળ રાખવાની;
- (ઝા) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
- (ટ) જાહેર ભિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
- (ઠ) રાખ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્ત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામૂહિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
- (ડ) માતા-પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.




*ભારતનું સંવિધાન : કલમ 51-ક

અનુક્રમણિકા

પ્રથમ સત્ર

ક્રમ	પ્રકરણનું નામ		પૂછ-નંબર
1.	સંખ્યાશાન (Numbers)	9,99,999	1
2.	સરવાળા-ભાડબાકી (Addition-Subtraction)	+ -	12
3.	ગુણાકાર-ભાગાકાર (Multiplication-Division)	× ÷	25
●	પુનરાવર્તન : 1 (Revision : 1)		37
4.	પૂર્ણ સંખ્યાઓ (Whole Numbers)	0 1 2 3 4 5 6	41
5.	વિભાજ્યતાની ચાવી (Divisibility Test)		50
6.	અવયવ-અવયવી (Factors-Multiples)		58
7.	પરિમિતિ અને ક્ષેત્રફળ (Perimeter and Area)		69
●	પુનરાવર્તન : 2 (Revision : 2)		85

દ્વિતીય સત્ર

ક્રમ	પ્રકરણનું નામ		પૃષ્ઠ-નંબર
8.	કેલ્ક્યુલેટર (Calculator)		90
9.	સરાસરી (Average)	$\frac{7+14+21}{3}$	94
10.	વર્તુળ (Circle)		101
11.	અપૂર્ણાંક (Fraction)		108
●	પુનરાવર્તન : 3 (Revision : 3)		127
12.	નફો-ખોટ (Profit-Loss)		129
13.	અજ્ઞાત સંખ્યા (Unknown Numbers)	a, b, c	139
14.	ત્રિકોણ (Triangle)		147
15.	ખૂણાની રચના (Construction of Angles)		153
●	પુનરાવર્તન : 4 (Revision : 4)		160


ગાણિક

ધોરણા 5

(દ્વિતીય સત્ર)

- નવું શીખીએ :

બાળમિત્રો, તમે કેલક્યુલેટર જોયું છે ? તેનો ઉપયોગ ક્યારેય કર્યો છે ? ચાલો, આજે આપણે કેલક્યુલેટર વિશે માહિતી મેળવીએ. કેલક્યુલેટરને આપણે ગુજરાતીમાં ગાણનયંત્ર કહીએ છીએ. કેલક્યુલેટર વિવિધ પ્રકારના સેલમાંથી કે સૂર્યપ્રકાશમાંથી જીર્જ મેળવીને કાર્ય કરે છે.



સાધું કેલક્યુલેટર
(Simple Calculator)



સાયન્ટિફિક કેલક્યુલેટર
(Scientific Calculator)

અરે ! હવે તો મોબાઈલ અને કમ્પ્યુટરમાં પણ કેલક્યુલેટરની સગવડ જોવા મળે છે.

- કેલક્યુલેટરનો ઉપયોગ

કેલક્યુલેટરમાં ગાણિતિક કિયાઓ જેવી કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ વગેરે માટેનાં બટન હોય છે. તેની મદદથી આ બધી ગાણિતિક કિયાઓ ઝડપથી કરી શકાય છે. આ ઉપરાંત, સાયન્ટિફિક કેલક્યુલેટર દ્વારા ગણિતમાં આવતી વિશિષ્ટ ગણતરીઓ ચોકસાઈથી અને ઝડપથી થઈ શકે છે. કેલક્યુલેટર વડે મોટી સંખ્યાઓની અને વધારે સંખ્યાઓની ગણતરી કરવાનું સગવડભર્યું છે. કેલક્યુલેટરમાં ઉપર એક લંબચોરસ જોવા મળે છે. તેને સ્ક્રીન (Screen) કહે છે. કેલક્યુલેટરનાં બટન દબાવતાં સ્ક્રીન પર display થાય છે.

◆ કેલક્યુલેટરનાં વિવિધ બટનની ઓળખ અને ઉપયોગની સમજ :

બટન	ઉપયોગ
ON	કેલક્યુલેટરને ચાલુ કરવા માટે (જ્યારે કેલક્યુલેટર ચાલુ કરીએ, ત્યારે સ્ક્રીન પર '0' (શૂન્ય) દેખાય છે.)
OFF	કેલક્યુલેટર બંધ કરવા માટે
0 1 2 3 4 5 6 7 8 9	ગણતરીના અંકો તરીકે
.	દશાંશચિહ્ન દર્શાવવા માટે
+ - × ÷	પ્રાથમિક ગણિતિક કિયાઓ કરવા માટે
=	સમગ્ર ગણતરીનું અંતિમ પરિણામ જાણવા માટે
C અથવા CE	Clear અથવા Cancel Entry : કરેલી ગણતરી દૂર કરવા અથવા આખી ગણતરી ફરીથી કર્યા સિવાય રદ કરવા માટે
AC	All Clear અથવા All Cancel : કરેલી ગણતરી દૂર કરવા અથવા સ્ક્રીન પરના બધા જ અંકો દૂર કરવા માટે

ઉપર બતાવેલ બટનો લગભગ બધાં જ કેલક્યુલેટરમાં જોવા મળે છે. આ ઉપરાંત અમુક પ્રકારનાં કેલક્યુલેટરમાં Check , $\sqrt{ }$, MR , MC વગેરે જેવાં બટનો પણ જોવા મળે છે.

• બટન C અથવા CE ના ઉપયોગથી ફક્ત છેલ્લે દાખલ કરેલી સંખ્યા દૂર થાય છે. બાકીની ગણતરી યથાવતૂ રહે છે. જ્યારે AC બટનના ઉપયોગથી કરેલી તમામ ગણતરી દૂર થાય છે અને કેલક્યુલેટર નવી ગણતરી માટે તૈયાર થાય છે.

કેલ્ક્યુલેટરનો વ્યવહાર ઉપયોગ

તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ ક્યાં-ક્યાં થતો જોયો છે ? નોંધો.

હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી દાખલા ગણતા શીખીએ.

ઉદાહરણ 1 : $239 + 460$

કેલ્ક્યુલેટર પર આ ગણતરી કેવી રીતે કરી શકાય તે જોઈએ :

બટન હિસાવતાં	સ્ક્રીન પર દેખાશે
ON	0
2	2
3	23
9	239
+	239
4	4
6	46
0	460
=	699

આમ, $239 + 460 = 699$

સ્વાધ્યાય

1. કેલ્ક્યુલેટરની મદદથી નીચેની ગણતરી કરો :

- | | | |
|------------------|---------------------|-------------------|
| (1) $537 + 21$ | (2) $900 - 325$ | (3) $1522 + 5789$ |
| (4) $950 \div 5$ | (5) 570×25 | |

2. નીચેની ખાલી જગ્યા પૂરો :

- (1) કેલ્ક્યુલેટરને ગુજરાતીમાં કહેવાય.
- (2) કેલ્ક્યુલેટર પર કરેલી તમામ ગણતરીને દૂર કરવા બટનનો ઉપયોગ થાય છે.
- (3) 12 અને 15ના ગુણાકારનું અંતિમ પરિણામ જાણવા માટે કેલ્ક્યુલેટર પર બટન દબાવવું.
- (4) કેલ્ક્યુલેટર ચાલુ કરીએ, ત્યારે સ્કીન પર સૌપ્રથમ દેખાય છે.
- (5) **OFF** બટન કેલ્ક્યુલેટરને કરવા માટે વપરાય છે.

કેલ્ક્યુલેટરની કરામત :

નીચે દર્શાવેલ ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરો અને શું જોવા મળે છે તે જાણો :

$3367 \times \text{તમારી ઉંમર} \quad \times 3$

$1443 \times \text{તમારો હાજરીનંબર} \times 7$

$777 \times \text{તમારી જન્મતારીખ} \times 13$ (માત્ર તારીખ)

$259 \times \text{તમારા જન્મનું વર્ષ} \times 39$ (વર્ષના માત્ર એકમ-દશકના અંક
દા.ત., 2002 હોય તો 02)

$111 \times \text{તમારા મિત્રની ઉંમર} \times 91$



સ્વાધ્યાય

2. (1) ગણનયંત્ર (2) AC (3) = (બરાબર) (4) શૂન્ય (5) બંધ



- ◆ સંદર્ભસાહિત્યનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના કેલ્ક્યુલેટર વિશે વધુ જાણો.

જ નવું શીખીએ :

પ્રવૃત્તિ 1 :

બધા વિદ્યાર્થીઓ વર્ગની બહાર જાઓ. બે મિનિટમાં જેટલા કંકરા વીજી શકો, તેટલા લઈને આવો. હવે શિક્ષકની સૂચના મુજબ 5-5નાં જૂથમાં વહેંચાઈ જાઓ. જૂથના બધા વિદ્યાર્થીઓ પાસે કેટલા કંકરા છે તે ગણો. હવે જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે કંકરા વહેંચવા માટે શું કરીશું ? વિચારો....

હરિ પાસે 9, ધરતી પાસે 5, અનિલ પાસે 7, ફિરોઝ પાસે 8 અને સ્ટેલા પાસે 6 કંકરા છે. તેમણે જૂથના પાંચેય વિદ્યાર્થીઓના કંકરા લેગા કરી વચ્ચે મૂકી દીધા.

● પહેલી વખત આ રીતે વહેંચ્યા :

ત્યારબાદ પાંચેય વિદ્યાર્થીઓ વારાફરતી એક-એક કંકરો લેવા લાગ્યા. વચ્ચે મૂકેલા બધા કંકરા પૂરા થઈ ગયા પછી બધાએ પોતપોતાની પાસેના કંકરા ગણ્યા, તો બધા પાસે 7-7 કંકરા હતા.

● બીજી વખત આ રીતે વહેંચ્યા :

જૂથના પાંચેય વિદ્યાર્થીઓએ કંકરા લેગા કરી વચ્ચે મૂકી દીધા. ત્યાર બાદ જૂથના સત્યોની સંખ્યા વડે કંકરાની સંખ્યાનો ભાગાકાર કર્યો.

આથી કહી શકાય કે જૂથના દરેક સત્યોને મળતા કંકરા એ સરાસરી કંકરા કહેવાય.



ઉદાહરણ તરીકે,

મીત, જીત અને પ્રીત ત્રણ ભાઈઓ છે. ત્રણોય ભાઈઓ દરરોજ સાંજે દૂધ ઘેર-ઘેર પહોંચાડી તેના મહેનતાણાં પેટે અનુકૂળ રૂ 66, રૂ 54 અને રૂ 75 મેળવે છે. જો આ રકમ લેગી કરી તેઓ સરખે ભાગે વહેંચી લે, તો દરેકને ભાગે રૂ 65 આવે. અહીં રૂ 65 એ રૂ 66, રૂ 54 અને રૂ 75ની સરેરાશ છે એમ કહેવાય, જે નીચેના સૂત્રની મદદથી સમજાયે :

$$\begin{aligned} \text{સરાસરી} &= \frac{\text{આપેલી રકમોનો સરવાળો}}{\text{રકમોની કુલ સંખ્યા}} \\ &= \frac{66 + 54 + 75}{3} \\ &= \frac{195}{3} \\ &= 65 \quad \therefore \text{સરાસરી} = \text{રૂ } 65 \end{aligned}$$

સરાસરી શોધવાનું સૂત્ર :

$$\text{સરાસરી} = \frac{\text{આપેલી સંખ્યાઓનો સરવાળો}}{\text{કુલ સંખ્યા}}$$

- આપેલી સંખ્યાઓના સરવાળાને કુલ સંખ્યા વડે ભાગતાં મળેલ સંખ્યાને આપેલ સંખ્યાઓની સરાસરી કહે છે.
- સરાસરીને સરેરાશ પણ કહે છે.

ઉદાહરણ 1 : 23, 20, 19 અને 18ની સરાસરી શોધો.

ઉકેલ :

$$\begin{aligned} \text{સરાસરી} &= \frac{\text{આપેલી સંખ્યાઓનો સરવાળો}}{\text{કુલ સંખ્યા}} \\ &= \frac{23 + 20 + 19 + 18}{4} \\ &= \frac{80}{4} \\ &= 20 \quad \therefore \text{સરાસરી} = 20 \end{aligned}$$

ઉદાહરણ 2 : 150, 168, 124, 105, 143 અને 114ની સરાસરી શોધો.

ઉકેલ : સરાસરી = $\frac{\text{આપેલી સંખ્યાઓનો સરવાળો}}{\text{કુલ સંખ્યા}}$

$$= \frac{150 + 168 + 124 + 105 + 143 + 114}{6}$$

$$= \frac{804}{6}$$


$$= 134$$

∴ સરાસરી = 134

આપેલી રકમોના સરવાળાની સમાન ભાગે થયેલી વહેંચાણીને સરાસરી કહેવામાં આવે છે. સરાસરીને ‘સરેરાશ’ પણ કહી શકાય છે.

મહાવરો 1

કૂલમાં લખેલા અંકોની સરાસરી પતંગિયામાં આપેલી છે. તેમની જોડ બનાવી, જોડમાં સરખો રંગ પૂરો :



વ્યવહારુ કોયડાઓ :

આપણા રોજિંદા વ્યવહારમાં સરાસરીનો ઉપયોગ થતો રહે છે. ડિકેટમેચ જોતી વખતે ડિકેટરે બનાવેલા રનની સરાસરી, વરસાદની ઋષ્ટુમાં વરસેલા વરસાદની સરાસરી, વેપારીને થતાં નફા કે નુકસાનની સરાસરી, ઉનાળાની ઋષ્ટુ દરમિયાન અનુભવાતી દૈનિક ગરમીની સરાસરી વગેરે. આવા વ્યવહારુ ઉદાહરણોમાં સરાસરીનો ઉપયોગ જોઈએ.

ઉદાહરણ 3 : કહોણા પ્રાથમિક શાળામાં 320 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અઠવાડિયા દરમિયાન નીચે પ્રમાણે વિદ્યાર્થીઓ મધ્યાહ્નભોજનનો લાભ લે છે. તેના પરથી મધ્યાહ્નભોજનનો લાભ લેતાં વિદ્યાર્થીઓની સરાસરી શોધો.

વાર	સોમવાર	મંગળવાર	બુધવાર	ગુરુવાર	શુક્રવાર	શનિવાર
લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યા	300	285	304	297	279	257

ઉકેલ :

$$\begin{aligned} \text{સરાસરી} &= \frac{\text{કુલ લાભાર્થીની સંખ્યાનો સરવાળો}}{\text{કુલ દિવસો}} \\ &= \frac{300 + 285 + 304 + 297 + 279 + 257}{6} \\ &= \frac{1722}{6} \\ &= 287 \end{aligned}$$

∴ કહોણા પ્રાથમિક શાળામાં મધ્યાહ્નભોજનનો લાભ લેતાં વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા 287 છે.

ઉદાહરણ 4 : દક્ષિણ ભારતમાં આવેલ ત્સુનામીમાં અસર પામેલી બ્યક્ટિઓને મદદ કરવાના રાહતફંડમાં એક શાળાના ભાધ્યમિક વિભાગના 9 વર્ગમાંથી કુલ ₹ 4320 ફાળો ભેગો થયો અને પ્રાથમિક વિભાગના 8 વર્ગમાંથી કુલ ₹ 4163 ભેગા થયા. શાળાના દરેક વર્ગમાંથી સરેરાશ કેટલો ફાળો મળ્યો ગણાય ?

ઉકેલ :

$$\begin{aligned} \text{સરાસરી} &= \frac{\text{એકત્રિત થયેલા ફાળાની કુલ રકમ}}{\text{વર્ગોની સંખ્યા}} \\ &= \frac{4320 + 4163}{9 + 8} \\ &= \frac{8483}{17} \\ &= 499 \end{aligned}$$

∴ વર્ગ દીઠ સરેરાશ ફાળો ₹ 499 મળ્યો કહેવાય.

મહાવરો 2

- (1) એક વર્ગના પાંચ વિદ્યાર્થીઓનું વજન અનુક્રમે 50 કિગ્રા, 44 કિગ્રા, 36 કિગ્રા, 48 કિગ્રા અને 32 કિગ્રા છે. તેઓનું સરેરાશ વજન શોધો.
- (2) આદિત્યના ઈજનેરીના અભ્યાસના છ માસના ખર્ચના આંકડા રૂપિયામાં નીચે પ્રમાણે છે. તેના પરથી સરેરાશ માસિક ખર્ચ શોધો :
- ₹ 7200, ₹ 6428, ₹ 5250, ₹ 5426, ₹ 6776, ₹ 4326
- (3) હિનાબહેન ગામની દૂધમંડળીમાં નીચે મુજબ દરરોજ દૂધ ભરાવે છે, તો હિનાબહેને અઠવાડિયા દરમિયાન દૂધમંડળીમાં ભરાવેલ દૂધની સરાસરી શોધો :

વાર	સોમવાર	મંગળવાર	બુધવાર	ગુરુવાર	શુક્રવાર	શનિવાર	રવિવાર
કુલ દૂધ (લિટરમાં)	11.500	8.700	10.400	9.800	7.600	9.400	12.600

- (4) કેરીના એક વેપારીએ એપ્રિલ મહિનામાં 1200 કિગ્રા, મે મહિનામાં 1380 કિગ્રા, જૂન મહિનામાં 1320 કિગ્રા કેરી વેચી. આ વેપારીએ કરેલું કેરીનું સરેરાશ વેચાણ શોધો.
- (5) શક્કિલના પિતાજીની 6 મહિનાની આવકનો સરવાળો ₹ 67,590 છે. શક્કીનાના પિતાજીની 3 મહિનાની આવકનો સરવાળો ₹ 45,780 છે. માસિક સરાસરી આવક કોણી વધારે કહેવાય ? કેટલા રૂપિયા ?

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના જવાબ મેળવી ખાનાંમાં ભરો :

A				B		
				C		
				D		
E						
F						

- (A) પ્રથમ પાંચ ક્રમિક બે અંકની સંખ્યાઓની સરાસરી
- (B) એક અંકની, બે અંકની અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યાઓની સરાસરી
- (C) 15ના અવયવોની સરાસરી
- (D) 15, 18, 21, 24, 27ની સરાસરી
- (E) ચાર અંકની પ્રથમ પાંચ ક્રમિક સંખ્યાઓની સરાસરી
- (F) 100, 150, 200, 250ની સરાસરી

2. ગણતરી કરો :

- (1) વડોદરા શહેરના 5 મેથી 10 મે સુધીના દૈનિક તાપમાનના આંકડા (સેલ્સિસસમાં) નીચે પ્રમાણે હતા. આ દિવસોનું દૈનિક સરેરાશ તાપમાન શોધો. 42.5° , 40.7° , 41.1° , 40.3° , 39.9° , 41.5°

- (2) એક હોસ્પિટમાં અઠવાડિયા દરમિયાન 410 કિગ્રા ઘઉં, 390 કિગ્રા ચોખા અને 190 કિગ્રા તુવેરની દાળ વપરાય છે. હોસ્પિટમાં અઠવાડિયા દરમિયાન વપરાયેલ અનાજની સરાસરી શોધો.
- (3) એક દુકાનનો સોમવારથી શનિવાર સુધીનો દૈનિક વકરો અનુકૂળે ₹ 530, ₹ 655, ₹ 598, ₹ 498, ₹ 527 અને ₹ 516 છે, તો આ છ દિવસનો સરેરાશ વકરો કેટલા રૂપિયા થાય ?
- (4) કનુઅં પાંચ દાવમાં કરેલા રન અનુકૂળે 60, 34, 43, 51 અને 42 છે, જ્યારે મનુઅં સાત દાવમાં કરેલા રન અનુકૂળે 46, 61, 53, 68, 49, 50 અને 44 છે. સરાસરી રન શોધી નક્કી કરો કે કયો બેલાડી વધુ સારું રમે છે ? (બંને કોઈ પણ દાવમાં આણનભ રહેલા નથી.)
- (5) (A) તમારા વર્ગના 10 વિદ્યાર્થીઓનાં વજનની સરાસરી શોધો.
(B) તમારા વર્ગના વિદ્યાર્થીઓના અઠવાડિયાની દૈનિક હાજરીની સરાસરી શોધો.



મહાવરો 2

1. (1) 42 કિગ્રા (2) ₹ 5901 (3) 10 લિટર (4) 1300 કિગ્રા
(5) શકીનાના પિતાજીની માસિક સરાસરી આવક ₹ 3995 વધારે કહેવાય.

સ્વાચ્છાય

1. (A) 12 (B) 37 (C) 6 (D) 21 (E) 1002 (F) 175
2. (1) 41° સેલ્સિયસ (2) 330 કિગ્રા (3) ₹ 554 (4) મનુ વધારે સારું રમે છે.




10

વર्तुળ (Circle)

આપણી આસપાસ એવી ઘણી વस્તુઓ જોવા મળે છે, જેનો આકાર ગોળ હોય છે.

દા.ત., દડો, લીલુ, નારંગી

તમારી આસપાસ જોવા મળતી ગોળ વस્તુઓની યાદી બનાવો.




શું આ વસ્તુઓને આપણે વર્તુળ કહી શકીએ ?

નીચે કેટલીક આકૃતિઓ આપેલી છે, તેમાંથી આપણે વર્તુળ કોને કહીશું ?



પ્રવૃત્તિ 1 :

તમારી આસપાસ જોવા મળતી વस્તુઓ કે જે વર્તુળકાર છે, તેને એક કાગળ પર રાખી, તેની ફરતે પેન્સિલ ફેરવી આકૃતિ બનાવો.


**વર્તુળકાર વસ્તુઓની ધાર (કિનારી) એટલે વર્તુળ****પ્રવૃત્તિ 2 :**

એક દોરાના એક છેડે પેન્સિલ બાંધો અને બીજા છેડે ટાંકણી બાંધી કાગળના એક બિંદુ પર સ્થિર રાખો. હવે પેન્સિલને એવી રીતે ફેરવો કે દોરો સીધો રહે. આપણો જોયું કે આવી રીતે તૈયાર થયેલ આકૃતિ વર્તુળ છે.


જ્યાં દોરાનો સ્થિર ભાગ હતો, તે બિંદુ દોરેલા વર્તુળનું કેન્દ્ર થશે.

● ત્રિજ્યા :**પ્રવૃત્તિ 3 :**

- કાગળ ઉપર વર્તુળ દોરી તેને કાપી લો.
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણો કાગળની ગડી વાળો અને ગડી ઉકેલો.



- નીચે દર્શાવેલ આકૃતિ જેવી ગડીઓ જોવા મળશે.
- ગડીઓ પર પેન્સિલ અને માપપદ્ધીની મદદથી લીટી દોરો.
- ત્યારબાદ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે નામનિર્દ્દશન કરો :




- આપેલ આકૃતિમાં \overline{OA} , \overline{OB} , \overline{OC} , \overline{OD} , \overline{OE} , \overline{OF} , \overline{OG} , \overline{OH} એ વર્તુળની ત્રિજ્યાઓ છે.
તમે આકૃતિમાં જોઈ શકો છો કે, દરેક ત્રિજ્યાનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર છે તથા બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ છે.
- જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય, તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે.
- આપેલ વર્તુળમાં માપપદ્ધીની મદદથી દરેક ત્રિજ્યાનું માપન કરો. દરેક વખતે માપન કરતાં તમને શું જોવા મળ્યું ?


● જીવા અને વ્યાસ :

પ્રવૃત્તિ 4:

- કાગળ ઉપર એક વર્તુળ દોરી કાપી લો.
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગડી વાળો અને ઉકેલો.




- નીચે દર્શાવેલ આકૃતિ જેવી ગડીઓ મળશે. તેનું નામનિર્દ્દશન કરો :



- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દરેક રેખાખંડ વર્તુળનાં કોઈ પણ બે બિંદુને જોડે છે.
- વર્તુળ પરનાં કોઈ પણ બે બિંદુને જોડતાં રેખાખંડને જીવા કહેવાય.
- અથવા
- જે રેખાખંડનાં બંને અંત્યબિંદુઓ વર્તુળ પરનાં બિંદુઓ હોય, તો તે રેખાખંડને વર્તુળની જીવા કહે છે.

- \overline{AB} , \overline{CD} , \overline{EF} વર્તુળની જીવાઓ છે. તેમને માપો.
- સૌથી મોટું માપ કઈ જીવાનું છે ?
- કઈ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે ?
- \overline{CD} એ વર્તુળની સૌથી મોટી જીવા છે, જે વર્તુળનો વ્યાસ છે.
- વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે.
- તે વર્તુળની સૌથી મોટી જીવા છે.
- નિયમા અને વ્યાસનો સંબંધ :



- માપપદ્ધીની મદદથી \overline{OA} તથા \overline{OB} માપો.
- $OA = \dots\dots\dots$ સેમી અને $OB = \dots\dots\dots$ સેમી
- હવે, \overline{AB} માપો. $AB = \dots\dots\dots$ સેમી
- માટે, $AB = \dots\dots\dots + \dots\dots\dots$
- OA અને AB વચ્ચે શો સંબંધ છે ? _____
- OB અને AB વચ્ચે શો સંબંધ છે ? _____

- व्यास ए त्रिज्या करतां बमणो होय छे.

तेथी, व्यास = त्रिज्या + त्रिज्या अथवा $2 \times$ त्रिज्या

उदाहरण 1 :

$$\text{त्रिज्या} = 5 \text{ मी}$$

$$\text{व्यास} = 2 \times \text{त्रिज्या}$$

$$= 2 \times 5$$

$$= 10 \text{ मी}$$

उदाहरण 2 :

$$\text{त्रिज्या} = 10.5 \text{ सेमी}$$

$$\text{व्यास} = 2 \times \dots \dots \dots$$

$$= 2 \times \dots \dots \dots$$

$$= \dots \dots \dots \text{सेमी}$$

उदाहरण 3 :

$$\text{त्रिज्या} = 11.5 \text{ सेमी}$$

$$\text{व्यास} = \dots \dots \dots \times \text{त्रिज्या}$$

$$= 2 \times \dots \dots \dots$$

$$= \dots \dots \dots \text{सेमी}$$

- त्रिज्या व्यास करतां अडधी होय छे.

तेथी, त्रिज्या = व्यास \div 2

उदाहरण 4 :

$$\text{व्यास} = 22 \text{ सेमी}$$

$$\text{त्रिज्या} = \text{व्यास} \div 2$$

$$= 22 \div 2$$

$$= 11 \text{ सेमी}$$

उदाहरण 5 :

$$\text{व्यास} = 15 \text{ सेमी}$$

$$\text{त्रिज्या} = \text{व्यास} \div 2$$

$$= 15 \div \dots \dots \dots$$

$$= 7.5 \text{ सेमी}$$

उदाहरण 6 :

$$\text{व्यास} = 12 \text{ मी}$$


$$\text{त्रिज्या} = \text{व्यास} \div 2$$

$$= \dots \dots \dots \div \dots \dots \dots$$

$$= \dots \dots \dots \text{मी}$$

મહावरो 1

1. આકृતिमાં દર્શાવેલ વર્તુળમાં વ्यાસ, જીવા, ત્રિજ્યા તથા વર્તુળનું કેન્દ્ર દર્શાવો :





(1)	વર્તુળનું કેન્દ્ર		(3)	વ्यાસ	
(2)	ત્રિજ્યા		(4)	જીવા	

2. આપેલ કોષ્ટકમાં ખૂટતી માહિતી પૂર્ણ કરો :

ક્રમ	ત્રિજ્યા	વ્યાસ	ક્રમ	ત્રિજ્યા	વ્યાસ	ક્રમ	ત્રિજ્યા	વ્યાસ
(1)	6 મીટર	(5)	8 સેમી	(9)	10 મીટર
(2)	16 સેમી	(6)	20 સેમી	(10)	8 મીટર
(3)	3.8 સેમી	(7)	8.1 મીટર	(11)	2.4 મી
(4)	70 સેમી	(8)	14 મીટર	(12)	11 મીટર

● આપેલ ત્રિજ્યાના આધારે વર્તુળ દોરવું :

ઉદાહરણ 7 : પરિકરની મદદથી 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો.

પગલું 1: પરિકર ખોલી તેને માપપણી પર એવી રીતે ગોઠવો કે જેથી પરિકરના અણીવાળા ભાગ અને પેન્સિલની અણી વચ્ચેનું અંતર 5 સેમી થાય.	
પગલું 2: કોરા કાગળ પર પરિકર ચોકસાઈથી મૂકો.	
પગલું 3: પરિકરના અણીવાળા ભાગને એક જ જગ્યાએ સ્થિર રાખી પેન્સિલવાળા ભાગને ફેરવવાથી વર્તુળ તૈયાર થશે. વર્તુળના કેન્દ્રને P નામ આપો.	

મહાવરો 2

આપેલ ત્રિજ્યાનાં માપ પરથી પરિકરની મદદથી વર્તુળ દોરો :

- (1) 3 સેમી (2) 4.5 સેમી (3) 6 સેમી (4) 5 સેમી (5) 3.5 સેમી

સ્વાધ્યાય

1. આપેલ ત્રિજ્યાનાં માપના આધારે વ્યાસનું માપ લખો :

- (1) 11 સેમી (2) 4.5 મી (3) 2.75 મી

2. આપેલ વ્યાસનાં માપ પરથી ત્રિજ્યાનું માપ લખો :

- (1) 7 મી (2) 40 સેમી (3) 22 સેમી

3. આપેલ ત્રિજ્યાનાં માપ પરથી પરિકરની મદદથી વર્તુળ દોરો :

- (1) 5.5 સેમી (2) 4 સેમી (3) 3.5 સેમી



મહાવરો 1

1. (1) O (2) \overline{OX} , \overline{OP} , \overline{OQ} (3) \overline{PQ} (4) \overline{PQ} , \overline{RS}

2. (1) 12 મી (2) 8 સેમી (3) 7.6 સેમી (4) 35 સેમી

(5) 16 સેમી (6) 10 સેમી (7) 16.2 મી (8) 7 મી

(9) 20 મી (10) 4 મીટર (11) 4.8 મી (12) 5.5 મી

સ્વાધ્યાય

1. (1) 22 સેમી (2) 9 મી (3) 5.50 મી

2. (1) 3.5 મી (2) 20 સેમી (3) 11 સેમી




11

અપૂર્ણાંક (Fraction)


આ કચેરીઓ :

- એક ચોરસ કે લંબચોરસ કાગળ લઈ નીચે મુજબ ગડી વાળો :



હવે કાગળ ખોલો. જ્યાં ગડી દેખાય, ત્યાં લીટી દોરો. આમ કરતાં એકસરખાં 16 ખાનાંવાળી આકૃતિ બનશે.

હવે તમારા કાગળના $\frac{1}{16}$ ભાગમાં લાલ, $\frac{3}{16}$ ભાગમાં લીલો, $\frac{5}{16}$ ભાગમાં પીળો અને બાકીના ભાગમાં કેસરી રંગ પૂરો. આ મુજબ નીચેની આકૃતિમાં પણ રંગ પૂરો :




- કેસરી રંગ કાગળનો _____ ભાગ દર્શાવે છે.


2. નીચેની આકૃતિઓમાંથી સમ-અપૂર્ણાક શોધો :




(i)



(a)




(ii)




(b)


$$\frac{4}{16} = \frac{1}{4}$$




(iii)



(c)



(iv)



(d)

3. નીચેના કાંઈ માં $<$, $>$ કે = પૈકી યોગ્ય નિશાની મૂકો :

(1) $\frac{3}{7}$ $\frac{6}{7}$

(2) $\frac{2}{5}$ $\frac{2}{5}$

(3) $\frac{8}{11}$ $\frac{3}{11}$

(4) $\frac{3}{17}$ $\frac{13}{17}$

(5) $\frac{9}{8}$ $\frac{14}{8}$

(6) $\frac{15}{9}$ $\frac{13}{9}$

જ) નવું શીખોએ :

જ) અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ

- $\frac{6}{9}$ ને $\frac{2 \times 3}{3 \times 3}$ લખી શકાય.

$$\begin{array}{c|c} 2 & 6 \\ \hline 3 & 3 \\ \hline & 1 \end{array}$$

6 = 2 × 3

$$\begin{array}{c|c} 3 & 9 \\ \hline 3 & 3 \\ \hline & 1 \end{array}$$

9 = 3 × 3

$$= \frac{2 \times 3}{3 \times 3} \quad (\text{અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતાં)$$

$$= \frac{2}{3}$$

∴ $\frac{6}{9}$ નું અતિસંક્ષિપ્ત રૂપ $\frac{2}{3}$ છે.

- $\frac{12}{18}, \frac{24}{28}, \frac{20}{30}, \frac{36}{54}$ નું અતિસંક્ષિપ્ત રૂપ $\frac{2}{3}$ મળે છે ખરું ? કરી જુઓ.

$\frac{12}{18}$	$\frac{24}{28}$	$\frac{20}{30}$	$\frac{36}{54}$

જેમનું અતિસંક્ષિપ્ત રૂપ $\frac{2}{3}$ હોય, તેવા બીજા અપૂર્ણાંકોનાં ઉદાહરણ આપો.

- $\frac{6}{10} = \frac{2 \times 3}{2 \times 5}$ (અંશ અને છેદના અવિભાજ્ય અવયવો પાડતાં)

$$= \frac{2 \times 3}{2 \times 5} \quad (\text{સામાન્ય અવયવો દૂર કરતાં)$$

$$= \frac{3}{5}$$

∴ $\frac{6}{10}$ નું અતિસંક્ષિપ્ત રૂપ $\frac{3}{5}$ છે.

- $\frac{9}{20}, \frac{12}{20}, \frac{18}{30}, \frac{30}{50}$ નું અતિસંક્ષિપ્ત રૂપ $\frac{3}{5}$ મળે છે ખરું? ખાતરી કરી જુઓ.

$\frac{9}{20}$	$\frac{12}{20}$	$\frac{18}{30}$	$\frac{30}{50}$

જેમનું અતિસંક્ષિપ્ત રૂપ $\frac{3}{5}$ હોય, એવા બીજા કેટલા અપૂર્ણાંકો હશે?

અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ મેળવવા...

- જે-તે અપૂર્ણાંકના અંશ અને છેદના અવિભાજ્ય અવયવો પાડો.
- અંશ અને છેદના સામાન્ય અવયવોને દૂર કરો.
- છેલ્લો અપૂર્ણાંકનું જે સ્વરૂપ મળે તેને જે-તે અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત રૂપ કહે છે.

મહાવરો 1

1. અતિસંક્ષિપ્ત રૂપ મેળવો :

(1) $\frac{4}{16}$

(2) $\frac{18}{27}$

(3) $\frac{22}{55}$

(4) $\frac{39}{52}$

(5) $\frac{90}{50}$


(6) $\frac{36}{76}$

યાદ કરીએ :

સમયેટી અપૂર્ણકો :






1. નીચેનાં દરેક ખાનાની આકૃતિના

$\frac{1}{2}$ ભાગમાં રંગ પૂરો :








2. નીચેનાં દરેક ખાનાની આકૃતિના

$\frac{1}{4}$ ભાગમાં રંગ પૂરો :



3. નીચેની આકૃતિઓના રંગને ભાગને અપૂર્ણક સ્વરૂપે દર્શાવો :



જ વિચારો અને કહો :

- (1) આ બધા અપૂર્ણકમાં સૌથી મોટો અપૂર્ણક ક્યો છે ? _____
- (2) આ બધામાં સૌથી નાનો અપૂર્ણક ક્યો છે ? _____
- (3) $\frac{1}{6}$ થી મોટા અપૂર્ણકો ક્યા છે ? _____
- (4) $\frac{4}{6}$ થી નાના અપૂર્ણકો ક્યા-ક્યા છે ? _____
- (5) $\frac{2}{6}$ થી મોટો અને $\frac{4}{6}$ થી નાનો અપૂર્ણક ક્યો છે ? _____

આ બધા અપૂર્ણકના છેદ વિશે શું કહી શકાય ? _____

સરખા છેદવાળા અપૂર્ણકોને સમયછેદી અપૂર્ણકો કહે છે.

● વિષમચેદી અપૂર્ણકો :

રંગીન ભાગ કયો અપૂર્ણક દર્શાવે છે તે લખો :














ધ્યાનથી જુઓ. અહીં દરેક અપૂર્ણકના છેદ સરખા નથી. જે અપૂર્ણકોના છેદ સમાન ન હોય, તે અપૂર્ણકોને વિષમચેદી અપૂર્ણકો કહેવાય.

● નવું શીખો :

● સમચેદી અપૂર્ણકના સરવાળા :



● નીચે આપેલી આકૃતિ પરથી ખાલી જગ્યા પૂરો :



(1) આકૃતિમાં એકસરખા માપના 32 ટ્રિકોણો છે.

(2) અહીં ની સંખ્યા _____ છે. તે આખી આકૃતિનો _____ ભાગ રોકે છે.

(3) અહીં ની સંખ્યા _____ છે. તે આખી આકૃતિનો _____ ભાગ રોકે છે.

- (4) અહીં  ની સંખ્યા _____ છે. તે આખી આકૃતિનો _____ ભાગ રોકે છે.
- (5) અહીં  ની સંખ્યા _____ છે. તે આખી આકૃતિનો _____ ભાગ રોકે છે.
- (6)  અને  બંને મળીને આખી આકૃતિનો કેટલો ભાગ રોકે છે ? તે જાણવા શું કરશો ?

● જુઓ અને સમજો :

ગુલાબી રંગના ત્રિકોણો આકૃતિનો $\frac{3}{32}$ ભાગ અને વાદળી રંગના ત્રિકોણો $\frac{9}{32}$ ભાગ રોકે છે. બંને રંગના કુલ ત્રિકોણો મળીને આખી આકૃતિનો કેટલો ભાગ રોકે છે, તે જાણવા તેનો સરવાળો કરવો પડે.

$$\frac{3}{32} + \frac{9}{32}$$

$$= \frac{3+9}{32} \quad (\text{બંને અપૂર્ણકના અંશનો સરવાળો અંશમાં કરી છેદમાં તેમનો સમાન છેદ લખતાં)$$

$$= \frac{12}{32}$$

$$= \frac{2 \times 2 \times 3}{2 \times 2 \times 2 \times 2 \times 2} = \frac{3}{8}$$

$$\therefore \frac{3}{32} + \frac{9}{32} = \frac{3}{8}$$

આમ પણ કરી શકાય :

$$\frac{3 \times 4}{8 \times 4} = \frac{3}{8}$$

આમ, ગુલાબી અને વાદળી રંગના ત્રિકોણો આખી આકૃતિનો $\frac{3}{8}$ ભાગ રોકે છે.

સમયેદી અપૂર્ણકોનો સરવાળો કરતી વખતે બધા અંશનો સરવાળો અંશમાં લખાય છે, પણ છેદ તેનો તે જ રહે છે. એટલે કે છેદ બદલાતો નથી.

ઉદાહરણ 1 : $2\frac{1}{5} + 1\frac{2}{5}$

ઉકેલ : રીત 1 :

$$\begin{aligned} &= 2 + \frac{1}{5} + 1 + \frac{2}{5} \\ &= 2 + 1 + \frac{1}{5} + \frac{2}{5} \\ &= 3 + \frac{1}{5} + \frac{2}{5} \\ &= 3 + \frac{1+2}{5} \\ &= 3 + \frac{3}{5} = 3\frac{3}{5} \end{aligned}$$

રીત 2 :

$$\begin{aligned} &= 2\frac{1}{5} + 1\frac{2}{5} \\ &= \frac{11}{5} + \frac{7}{5} \quad (\text{અશુદ્ધ અપૂર્વિક બનાવતાં}) \\ &= \frac{11+7}{5} \\ &= \frac{18}{5} \\ &= 3\frac{3}{5} \end{aligned}$$

$$\therefore 2\frac{1}{5} + 1\frac{2}{5} = 3\frac{3}{5}$$

ઉદાહરણ 2: $\frac{5}{11} + \frac{3}{11} + \frac{7}{11}$

ઉકેલ :

$$\begin{aligned} &\frac{5}{11} + \frac{3}{11} + \frac{7}{11} \\ &= \frac{5+3+7}{11} \\ &= \frac{15}{11} \\ &= 1\frac{4}{11} \end{aligned}$$

$$\therefore \frac{5}{11} + \frac{3}{11} + \frac{7}{11} = 1\frac{4}{11}$$


મહાવરો 2

1. સરવાળો કરો :

- | | |
|-------------------------------------|-----------------------------------|
| (1) $\frac{13}{24} + \frac{10}{24}$ | (2) $\frac{3}{7} + 1\frac{2}{7}$ |
| (3) $\frac{7}{23} + \frac{8}{23}$ | (4) $4\frac{2}{5} + 3\frac{4}{5}$ |


2. નીચે આપેલા લંબચોરસની પરિમિતિ શોધો :

$4\frac{1}{2}$ સેમી



$2\frac{1}{2}$ સેમી

3. નીચે આપેલા ત્રિકોણની પરિમિતિ શોધો :



4. બાજુમાં આપેલા ચોરસમાંથી કોઈ પણ બે અપૂર્ણાંકો પસંદ કરી, તેમનો સરવાળો કરીને તમારી નોટબુકમાં નોંધો :

$\frac{1}{8}$	$\frac{7}{8}$	$\frac{3}{8}$	$\frac{4}{8}$
$\frac{5}{8}$	$\frac{2}{8}$	$\frac{6}{8}$	$\frac{7}{8}$
$\frac{3}{8}$	$\frac{4}{8}$	$\frac{5}{8}$	$\frac{2}{8}$

- (1) તમે વધુમાં વધુ કેટલી રકમ બનાવી શકશો ?
- (2) તમે કરેલા સરવાળામાં સૌથી મોટો અપૂર્ણાંક ક્યો મળ્યો ?
- (3) સૌથી નાનો અપૂર્ણાંક ક્યો મળ્યો ?

વિચારો....

આ જાડુઈ ચોરસ છે, કેવી રીતે ?

$\frac{2}{17}$	$\frac{7}{17}$	$\frac{6}{17}$
$\frac{9}{17}$	$\frac{5}{17}$	$\frac{1}{17}$
$\frac{4}{17}$	$\frac{3}{17}$	$\frac{8}{17}$

- (1) દરેક આડી હરોળના અપૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય ? _____
- (2) દરેક ઉભી હરોળના અપૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય ? _____


(3) તમે આવો 3×3 નો જાડુઈ ચોરસ બનાવો.

● સમયેદી અપૂર્ણકોની બાદબાકી :

■ જુઓ અને સમજો :

ઉદાહરણ 3 : $\frac{7}{8} - \frac{5}{8}$

ઉકેલ :



$$\frac{7}{8} - \frac{5}{8}$$

$$= \frac{7-5}{8}$$

$$= \frac{2}{8}$$

$$= \frac{1}{4}$$

ઉદાહરણ 4 : $\frac{5}{6} - \frac{2}{6}$

ઉકેલ :

$$= \frac{5-2}{6}$$

$$= \frac{3}{6}$$

$$= \frac{1}{2}$$

$$\therefore \frac{7}{8} - \frac{5}{8} = \frac{1}{4}$$

$$\therefore \frac{5}{6} - \frac{2}{6} = \frac{1}{2}$$

મહાવરો 3

1. બાદબાકી કરો :

(1) $\frac{6}{9} - \frac{2}{9}$

(2) $\frac{5}{7} - \frac{3}{7}$

(3) $\frac{11}{29} - \frac{8}{29}$

(4) $3\frac{4}{8} - \frac{19}{8}$

(5) $2\frac{3}{19} - 1\frac{5}{19}$

(6) $3\frac{5}{17} - 2\frac{4}{17}$

2.

$\frac{8}{23}$	$\frac{3}{23}$	
$\frac{4}{23}$	$\frac{2}{23}$	

$\frac{5}{13}$	$\frac{7}{13}$	
$\frac{2}{13}$	$\frac{5}{13}$	

● દશાંશ-અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકનું પરસ્પર રૂપાંતર :

● દશાંશ-અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર :

● જુઓ અને સમજો :

ક્રમ	દશાંશ-અપૂર્ણાંક	સાદો અપૂર્ણાંક
(1)	0.1	$\frac{1}{10}$
(2)	0.7
(3)	0.03	$\frac{3}{100}$
(4)	0.05
(5)	0.21	$\frac{21}{100}$
(6)	4.7
(7)	10.17	$\frac{1017}{100} = 10 \frac{17}{100}$
(8)	31.19
(9)	0.009	$\frac{9}{1000}$
(10)	0.007
(11)	0.141	$\frac{141}{1000}$
(12)	10.343	$\frac{10343}{1000} = 10 \frac{343}{1000}$
(13)	3.781

દશાંશ-અપૂર્ણાંકનું સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરતાં જો રૂપાંતર કરેલ અપૂર્ણાંક અતિ-સંક્ષિપ્ત રૂપમાં ન હોય, તો તેનું અતિસંક્ષિપ્ત રૂપ અવશ્ય મેળવવું જોઈએ. જેમકે,

$$0.6 = \frac{6}{10} = \frac{2 \times 3}{2 \times 5} = \frac{3}{5}$$

$$0.75 = \frac{75}{100} = \frac{3 \times 5 \times 5}{4 \times 5 \times 5} = \frac{3}{4}$$

$$3.125 = 3\frac{125}{1000} = 3\frac{5 \times 5 \times 5 \times 1}{5 \times 5 \times 5 \times 8} = 3\frac{1}{8}$$

● સાદો અપૂર્ણાંકનું દશાંશ-અપૂર્ણાંકમાં રૂપાંતર :

સાદો અપૂર્ણાંક	દશાંશ-અપૂર્ણાંક
$\frac{3}{10}$	0.3
$\frac{18}{100}$	0.18
$3\frac{675}{1000}$	3.675
$\frac{1}{2}$	$\frac{1 \times 5}{2 \times 5} = \frac{5}{10} = 0.5$
$\frac{7}{2}$
$\frac{19}{25}$	$\frac{19 \times 4}{25 \times 4} = \frac{76}{100} = 0.76$
$1\frac{12}{25}$
$5\frac{4}{125}$	$5\frac{4 \times 8}{125 \times 8} = 5\frac{32}{1000} = 5.032$
$7\frac{2}{125}$

$2\frac{11}{20}$	$2\frac{11 \times 5}{20 \times 5} = 2\frac{55}{100} = 2.55$
$7\frac{2}{25}$
$\frac{7}{40}$	$\frac{7 \times 25}{40 \times 25} = \frac{175}{1000} = 0.175$
$\frac{3}{40}$

સાદા અપૂર્ણાંકનું દશાંશ-અપૂર્ણાંકમાં રૂપાંતર કરતી વખતે જો અપૂર્ણાંકના છેદમાં 10, 100 કે 1000 ન હોય, ત્યારે તે અપૂર્ણાંકના અંશ અને છેદને ચોક્કસ સંખ્યા વડે ગુણી છેદમાં 10, 100 કે 1000 લાવવા પડે.

જ) નાણું, લંબાઈ, વજન અને ગુંજાશના એકમોમાં દશાંશ-અપૂર્ણાંક :

પરિમાણ	એકમો વચ્ચે સંબંધ	દશાંશ-અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતર
નાણું	1 રૂપિયા = 100 પૈસા	30 પૈસા = 0.30 રૂપિયા 3 રૂપિયા 50 પૈસા = 3.50 રૂપિયા 705 પૈસા = 7.05 રૂપિયા 15 રૂપિયા 5 પૈસા = 15.05 રૂપિયા
લંબાઈ	1 મીટર = 100 સેન્ટિમીટર મીટરને ટૂંકમાં મી લખાય. સેન્ટિમીટરને ટૂંકમાં સેમી લખાય. 1 કિલોમીટર = 1000 મીટર કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય.	45 સેમી = 0.45 મી 348 સેમી = 3.48 મી 17 મીટર 45 સેમી = 17.45 મી 8 સેમી = 0.08 મી 5 મીટર 7 સેમી = 5.07 મીટર 65 મીટર = 0.065 કિમી 9 કિમી 450 મી = 9.450 કિમી 18 કિમી 18 મી = 18.018 કિમી 3 કિમી 7 મી = 3.007 કિમી 4278 મી = 4.278 કિમી

વજન	1 કિલોગ્રામ = 1000 ગ્રામ કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા લખાય.	13 ગ્રામ = 0.013 કિગ્રા 7 કિગ્રા 5 ગ્રામ = 7.005 કિગ્રા 3 કિગ્રા 750 ગ્રામ = 3.750 કિગ્રા 4575 ગ્રામ = 4.575 કિગ્રા
ગુંજશ	1 લિટર = 1000 મિલીલિટર મિલીલિટરને ટૂંકમાં મિલિ લખાય.	250 મિલિ = 0.250 લિટર 5 લિટર 350 મિલિ = 5.350 લિટર 7 લિટર 50 મિલિ = 7.050 લિટર 3 લિટર 5 મિલિ = 3.005 લિટર
















મહાવરો 4

1. યોગ્ય વિકલ્પ પસંદ કરીને માં લખો :

- (1) 50 પૈસા = _____ રૂપિયા
- (A) 50 (B) 0.50 (C) 5.00 (D) 0.050
- (2) 2 રૂપિયા 50 પૈસા = _____ રૂપિયા
- (A) 0.250 (B) 25 (C) 2.50 (D) 0.0250
- (3) 18 ગ્રામ = _____ કિલોગ્રામ
- (A) 0.18 (B) 1.8 (C) 0.0018 (D) 0.018
- (4) 2 કિગ્રા 50 ગ્રામ = _____ કિલોગ્રામ
- (A) 2.050 (B) 2.50 (C) 2.500 (D) 2.005
- (5) 45 સેમી = _____ મીટર
- (A) 4.5 (B) 0.45 (C) 0.405 (D) 4.05
- (6) 9 મીટર 80 સેમી = _____ મીટર
- (A) 90.80 (B) 9.080 (C) 9.80 (D) 980

- (7) $8 \text{ મીટર} = \underline{\hspace{2cm}}$ કિલોમીટર
- (A) 0.08 (B) 0.80 (C) 0.080 (D) 0.008
- (8) $2 \frac{1}{2} \text{ મી} 65 \text{ મીટર} = \underline{\hspace{2cm}}$ કિલોમીટર
- (A) 2.65 (B) 2.065 (C) 2.650 (D) 26.5
- (9) $9 \frac{3}{4} \text{ મી} 750 \text{ મીટર} = \underline{\hspace{2cm}}$ કિલોમીટર
- (A) 9.750 (B) 97.5 (C) 9750 (D) 90.750
- (10) $500 \text{ મિલીલિટર} = \underline{\hspace{2cm}}$ લિટર
- (A) 500 (B) 0.050 (C) 0.500 (D) 0.005
- (11) $8 \text{ લિટર } 25 \text{ મિલીલિટર} = \underline{\hspace{2cm}}$ લિટર
- (A) 8.250 (B) 82.5 (C) 8.205 (D) 8.025
- (12) $8 \text{ લિટર } 8 \text{ મિલીલિટર} = \underline{\hspace{2cm}}$ લિટર
- (A) 8.8 (B) 8 (C) 8.008 (D) 8.08

● જુઓ, સમજો અને રંગ પૂરો :

- (1)     (?)
- (2)     (?)
- (3)     (?)
- (4)     (?)

● સમજો અને લખો :

(1) $\frac{2}{7}, \frac{5}{7}, \frac{8}{7}, \underline{\quad}$

(2) $\frac{17}{23}, \frac{15}{23}, \frac{13}{23}, \underline{\quad}$

(3) $\frac{9}{17}, \underline{\quad}, \frac{13}{17}, \frac{15}{17}$

(4) $\frac{21}{43}, \underline{\quad}, \frac{31}{43}, \frac{36}{43}$

સ્વાધ્યાય

1. અતિસંકિન રૂપ મેળવો :

(1) $\frac{6}{20} \quad (2) \frac{14}{56} \quad (3) 2\frac{2}{10} \quad (4) \frac{35}{49}$

2. સરવાળા કરો :

(1) $\frac{3}{5} + \frac{4}{5} \quad (2) \frac{4}{7} + 1\frac{4}{7} \quad (3) \frac{13}{19} + \frac{7}{19} \quad (4) 2\frac{3}{7} + 1\frac{4}{7} + \frac{5}{7}$

3. બાદબાકી કરો :

(1) $\frac{7}{8} - \frac{3}{8} \quad (2) \frac{11}{13} - \frac{5}{13} \quad (3) \frac{9}{16} - \frac{3}{16} \quad (4) 3\frac{2}{15} - 1\frac{1}{15}$

4. સાદા અપૂર્ણાંકમાં ફેરવો :

(1) 0.005 (2) 0.64 (3) 23.5 (4) 13.037

5. દરશાંશ-અપૂર્ણાંકમાં ફેરવો :

(1) $\frac{13}{100} \quad (2) \frac{403}{1000} \quad (3) 2\frac{1}{5} \quad (4) \frac{37}{200}$

6. ખાલી જગ્યા પૂરો :

- (1) 425 પૈસા = _____ રૂપિયા
- (2) 88 સેમી = _____ મીટર
- (3) 7 કિગ્રા 250 ગ્રામ = _____ કિગ્રા
- (4) 1765 ગ્રામ = _____ કિગ્રા
- (5) 3 લિટર 500 મિલીલિટર = _____ લિટર



મહાવરો 1

1. (1) $\frac{1}{4}$ (2) $\frac{2}{3}$ (3) $\frac{2}{5}$ (4) $\frac{3}{4}$ (5) $1\frac{4}{5}$ (6) $\frac{9}{19}$

મહાવરો 2

1. (1) $\frac{23}{24}$ (2) $1\frac{5}{7}$ (3) $\frac{15}{23}$ (4) $8\frac{1}{5}$ 2. 14 સેમી 3. 10 સેમી

મહાવરો 3

1. (1) $\frac{4}{9}$ (2) $\frac{2}{7}$ (3) $\frac{3}{29}$ (4) $1\frac{1}{8}$ (5) $\frac{17}{19}$ (6) $1\frac{1}{17}$

2.

			-				+
$\frac{8}{23}$	$\frac{3}{23}$	$\frac{5}{23}$		$\frac{5}{13}$	$\frac{7}{13}$	$\frac{12}{13}$	
$\frac{4}{23}$	$\frac{2}{23}$	$\frac{2}{23}$		$\frac{2}{13}$	$\frac{5}{13}$	$\frac{7}{13}$	
$\frac{4}{23}$	$\frac{1}{23}$	$\frac{3}{23}$		$\frac{3}{13}$	$\frac{2}{13}$	$\frac{5}{13}$	

મહાવરો 4

1. (1) B (2) C (3) D (4) A
 (5) B (6) C (7) D (8) B
 (9) A (10) C (11) D (12) C

સ્વાધ્યાય

1. (1) $\frac{3}{10}$ (2) $\frac{1}{4}$ (3) $2\frac{1}{5}$ (4) $\frac{5}{7}$
2. (1) $1\frac{2}{5}$ (2) $2\frac{1}{7}$ (3) $1\frac{1}{19}$ (4) $4\frac{5}{7}$
3. (1) $\frac{1}{2}$ (2) $\frac{6}{13}$ (3) $\frac{3}{8}$ (4) $2\frac{1}{15}$
4. (1) $\frac{5}{1000}$ (2) $\frac{64}{100}$ (3) $23\frac{5}{10}$ (4) $13\frac{37}{100}$
5. (1) 0.13 (2) 0.403 (3) 2.2 (4) 0.185
6. (1) 4.25 (2) 0.88 (3) 7.250 (4) 1.765 (5) 3.500



પુનરાવર્તન : 3 (Revision : 3)

1. જોડકાં જોડો :

અ

- (1) કેલ્ક્યુલેટર ચાલુ કરવા
- (2) દશાંશચિહ્ન દર્શાવવા
- (3) સમગ્ર ગણતરીનું અંતિમ પરિણામ જાણવા
- (4) સ્કીન પરના બધા અંકો દૂર કરવા
- (5) ગણતરી દરમિયાન થયેલ ભૂલને આખી ગણતરી ફરીથી કર્યા સિવાય રદ કરવા

બ

- (a) .
- (b) AC
- (c) ON
- (d) CE
- (e) ÷
- (f) =

2. ગણતરી કરીને ખાલી જગ્યા પૂરો :

- (1) સરાસરીને _____ તરીકે પણ ઓળખાય છે.
- (2) શરૂઆતની પાંચ કભિક બેકી સંખ્યાઓની સરાસરી _____ થાય.
- (3) 6ના પ્રથમ ત્રણ અવયવીની સરાસરી _____ થાય.
- (4) 21, 22, 23, 24 અને 25ની સરાસરી _____ થાય.
- (5) 20ના અવયવોની સરાસરી _____ થાય.

3. આપેલ કોષ્ટકમાં ખૂટતી વિગતો પૂર્ણ કરો :

વ્યાસ	13 સેમી	94 સેમી	10 મીટર	50 સેમી
ત્રિજ્યા	7 મીટર	4.5 સેમી

4. આપેલ ત્રિજ્યાનાં માપના આધારે પરિકરની મદદથી વર્તુળ ઢોરો :

- (1) 3 સેમી
- (2) 5.2 સેમી
- (3) 6.5 સેમી

5. નાના લંબચોરસમાં આપેલ અપૂર્ણાંક કોનું અતિસંક્ષિપ્ત રૂપ છે, તે તેની નીચે આપેલ મોટા લંબચોરસમાંથી શોધો અને જે-ને ખાનાંમાં યોગ્ય રંગ પૂરો :

$\frac{1}{2}$	$\frac{3}{4}$	$\frac{4}{5}$	$\frac{2}{7}$
---------------	---------------	---------------	---------------


$\frac{4}{14}$	$\frac{3}{6}$	$\frac{6}{8}$	$\frac{4}{8}$	$\frac{6}{21}$
$\frac{2}{4}$	$\frac{9}{12}$	$\frac{8}{10}$	$\frac{12}{16}$	$\frac{5}{10}$
$\frac{10}{20}$	$\frac{12}{15}$	$\frac{15}{20}$	$\frac{16}{20}$	$\frac{6}{12}$
$\frac{10}{35}$	$\frac{9}{18}$	$\frac{24}{30}$	$\frac{7}{14}$	$\frac{8}{28}$

6. ઉપરના કોષ્ટકમાંથી સમયેદી અપૂર્ણાંકોની જોડી બનાવો. હવે તેમનાં સરવાળા અને બાદબાકી કરો.



1. (1) \rightarrow (c) (2) \rightarrow (a) (3) \rightarrow (f) (4) \rightarrow (b) (5) \rightarrow (d)
2. (1) સરેરાશ (2) 6 (3) 12 (4) 23 (5) 7
3. 6.5 સેમી, 14 મીટર, 47 સેમી, 9 સેમી, 5 મીટર, 25 સેમી





- મામા :** કેમ ભાઈ! તમે બધા અહીં કેમ આવ્યા?
- ઉજાસ :** મામા, આ તો મેળો છે, એમ સાંભળ્યું, એટલે ફરવા આવ્યા. પણ આ તો કંઈ અલગ જ પ્રકારનો મેળો છે. અહીં તો ગાય, લેંસ, ઘોડા, બકરી, બળદ અને કૂતરા જેવાં પશુઓ લઈને લોકો આવ્યાં છે.
- મામા :** હા, આ તો પશુમેળો છે. દર વર્ષ અહીં પશુમેળો ભરાય છે. અહીં જુદા-જુદા પ્રદેશોમાંથી પશુપાલકો તેમનાં પશુઓ વેચવા અને ખરીદવા માટે આવે છે.
- ઉજાસ :** મામા, આ પશુઓની કિમત કેવી રીતે નક્કી થાય?
- મામા :** પશુઓને ખરીદનાર પશુઓનો ખૂબ જીણવટપૂર્વક અભ્યાસ કરે છે. દૂધ આપતાં પશુઓની કિમત તેમની જાત, ઉંમર અને એક ટંકે તે કેટલું દૂધ આપે છે, તેના આધારે નક્કી થાય છે.
- ઉજાસ :** હં.
- મામા :** બળદની કિમત તેના દેખાવ, ઉંમર અને સ્વાસ્થના આધારે થાય છે. ઘોડાની કિમત તેની જાત, દોડવાની ઝડપ અને બીજી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને થાય છે.
- ઉજાસ :** હં. આ તો નવું જાડવા મહ્યું.

મામા : અરે, મોતીભાઈ ! આ ગાય કેટલામાં ખરીદી ?

મોતીભાઈ : આ કંકરેજ ગાય તો મેં ફક્ત ₹ 22,000માં ખરીદી.

મામા : સરસ. હવે આ ગાય તમે જ રાખશો કે ગામ જઈને બીજાને વેચી દેશો ?

મોતીભાઈ : ના.... ના. હું જ રાખીશ.

ઉજાસ : હું મામા, તમે આ મેળામાં દર વર્ષ આવો છો ?

મામા : હા. હું દર વર્ષ આવું છું અને ઘણાં પશુઓની લે-વેચ કરું છું.

ઉજાસ : આ વખતે તમે શી લે-વેચ કરી ?

મામા : જો, આજે મેં કરેલી લે-વેચ નીચે મુજબ છે :




₹ 2000 ખરીદી
₹ 2200 વેચાણ

ફાયદો



₹ 27000 ખરીદી
₹ 25000 વેચાણ


નુકસાન



₹ 28000 ખરીદી
₹ 30000 વેચાણ



₹ 38000 ખરીદી
₹ 41000 વેચાણ



₹ 44000 ખરીદી
₹ 51000 વેચાણ



₹ 1600 ખરીદી
₹ 1500 વેચાણ

- ફાયદો એટલે નફો
- નુકસાન એટલે ખોટ
- જે કિમત આપીને વસ્તુ ખરીદાય તે કિમતને ખરીદકિમત અથવા મૂળ કિમત કહેવાય.
- જે કિમતે વસ્તુ વેચાય તે કિમતને વેચાણકિમત કહેવાય.

- હવે ઉપરનાં ઉદાહરણોમાંથી ખરીદકિમત અને વેચાણકિમત શોધીને નીચેના કોષ્ટકમાં લખો. તેમની સરખામણી કરીને ○ માં યોગ્ય ચિહ્ન < કે > લખો અને ખાલી જગ્યા પૂરો :

પણુ	ખરીદકિમત	સરખામણી	વેચાણકિમત	નફો કે ખોટ	કેટલા રૂપિયા
બકરી	₹	○	₹		
ગાય	₹	○	₹		
ભેંસ	₹	○	₹		
કૂતરો	₹	○	₹		
બળદ	₹	○	₹		
ઘોડો	₹	○	₹		

આમ, ખરીદકિમત કરતાં વેચાણકિમત વધારે હોય, ત્યારે નફો થાય છે. તેથી,

$$\text{નફો} = \text{વેચાણકિમત} - \text{ખરીદકિમત}$$

$$\text{નફો} = \text{વેચાણકિમત} - \text{મૂળ કિમત}$$

ખરીદકિમત કરતાં વેચાણકિમત ઓછી હોય, ત્યારે ખોટ થાય છે. તેથી,

$$\text{ખોટ} = \text{ખરીદકિમત} - \text{વેચાણકિમત}$$

$$\text{ખોટ} = \text{મૂળ કિમત} - \text{વેચાણકિમત}$$

મહાવરો 1

1. ખરીદકિમત અને વેચાણકિમત જણાવો :

- (1) ₹ 5માં ખરીદેલ પેન ₹ 6માં વેચી.
- (2) ₹ 70માં ખરીદેલું દઢી વેચતાં ₹ 80 મળ્યા.
- (3) ₹ 350માં ખરીદેલું કાપડ ₹ 450માં વેચ્યું.
- (4) ₹ 680માં ખરીદેલ શાકભાજી વેચતાં ₹ 640 મળ્યા.

2. સાચો જવાબ લખો :

ક્રમ	વસ્તુ	ખરીદકિમત	વેચાણકિમત	નફો કે ખોટ	કેટલા રૂપિયા
(1)		17 રૂપિયા	20 રૂપિયા
(2)		18 રૂપિયા	20 રૂપિયા
(3)		12 રૂપિયા	15 રૂપિયા
(4)		24 રૂપિયા	30 રૂપિયા
(5)		60 રૂપિયા	66 રૂપિયા
(6)		20 રૂપિયા	18 રૂપિયા
(7)		90 રૂપિયા	100 રૂપિયા
(8)		65 રૂપિયા	60 રૂપિયા

- ઉજાસ** : મામા, તમે અહીંથી ખરીદેલાં પ્રાણીઓ બીજી જગ્યાએ પણ વેચો છો ?
- મામા** : હા. ગયા વર્ષ મેં અહીંથી ખરીદેલાં પ્રાણીઓ બીજે ગામે જઈને વેચ્યાં હતાં.
- ઉજાસ** : તે પ્રાણીઓને ત્યાં કેવી રીતે લઈ ગયાં ?
- મામા** : પહેલાં તો મેં અહીંથી ₹ 37,000માં બળદની જોડ ખરીદી. તેમને બીજે ગામે લઈ જવાના ટેમ્પાના ભાડા માટે ₹ 700 આપ્યા. પછી આ જોડીને ₹ 44,000માં વેચી દીધી.

(1) મામાએ બળદોની જોડી કેટલા રૂપિયામાં ખરીદી ?

(2) મામાએ ટેમ્પાના ભાડાના કેટલા રૂપિયા આપ્યા ?

(3) મામાએ બળદોની જોડીની ખરીદકિંમત સિવાય વધારાનો કુલ ખર્ચ કેટલો કર્યો ?

અહીં વધારાના ખર્ચના ₹ 700 એ ખરાજત છે. તેને મૂળ કિંમતમાં ઉમેરતાં પડતર કિંમત મળે.

$$\text{₹ } 37,000 + \text{₹ } 700 = \text{₹ } 37,700$$

વસ્તુ ખરીદ્યા પછી તેના માટે ઘણા પ્રકારના ખર્ચ થાય છે. જેમકે, લાવવા-લઈ જવાનું ભાડું, સમારકામ, રંગકામ, મજૂરી વગેરે. આવા તમામ પ્રકારના ખર્ચને ખરાજત કહેવાય.

- ખરાજતને મૂળ કિંમત/ખરીદકિંમતમાં ઉમેરતાં વસ્તુની પડતર કિંમત મળે.

$$\text{પડતર કિંમત} = \text{ખરીદકિંમત} + \text{ખરાજત}$$

- વ્યવહારમાં નફો અને ખોટની ગણતરી પડતર કિંમત અને વેચાણકિંમતના આધારે જ થાય છે.

નફો = વેચાણકિંમત - પડતર કિંમત

ખોટ = પડતર કિંમત - વેચાણકિંમત

ઉઝાસ : એટલે મામા, બળદોની જોડી વેચતાં તમને ₹ 44,000 - ₹ 37,700
= ₹ 6300નો ફાયદો થયો.

ઉદાહરણ 1 : એક વેપારીએ અમુક માટલાં ₹ 3000માં ખરીદ્યાં. તેને શહેરમાં લઈ જવાનું ભાડું ₹ 300 થયું. બધાં માટલાં વેચતાં તેને ₹ 3200 મળ્યા. તેને કેટલા રૂપિયા નફો કે ખોટ થાય ?

ઉકેલ : ખરીદકિંમત = ₹ 3000 ખર્ચ = ₹ 300

$$\therefore \text{માટલાંની પડતર કિંમત} = \text{ખરીદકિંમત} + \text{ખરાજત}$$

$$= ₹ 3000 + ₹ 300$$

$$= ₹ 3300$$

અહીં પડતર કિંમત > વેચાણકિંમત

તેથી, ખોટ = પડતર કિંમત - વેચાણકિંમત

$$= ₹ 3300 - ₹ 3200$$

$$= ₹ 100$$

∴ વેપારીને ₹ 100 ખોટ થાય.

ઉદાહરણ 2 : એક વેપારીએ ₹ 7000ના ફટાકડા ખરીદ્યા. તેને દુકાન સુધી લાવવાનું ભાડું ₹ 500 થયું. આ બધા જ ફટાકડા વેચતાં તેને ₹ 9800 મળ્યા, તો તેને નફો થયો કે ખોટ ? કેટલા રૂપિયા ?

ઉકેલ : ખરીદકિમત = ₹ 7000, ખર્ચ = ₹ 500, વેચાણકિમત = ₹ 9800
 \therefore ફટાકડાની પડતર કિમત = ખરીદકિમત + ખરાજાત

$$\begin{aligned} &= ₹ 7000 + ₹ 500 \\ &= ₹ 7500 \end{aligned}$$

અહીં પડતર કિમત < વેચાણકિમત

$$\begin{aligned} \text{તેથી, નફો} &= \text{વેચાણકિમત} - \text{પડતર કિમત} \\ &= ₹ 9800 - ₹ 7500 \\ &= ₹ 2300 \end{aligned}$$

\therefore વેપારીને ₹ 2300 નફો થયો.

મહાવરો 2

1. ખાલી જગ્યા પૂરો :

ક્રમ	ખરીદકિમત	ખરાજાત	પડતર કિમત	વેચાણકિમત	નફો/ખોટ	કેટલા રૂપિયા
દા.ત.,	₹ 1000	₹ 50	₹ 1050	₹ 1200	નફો	₹ 150
1	₹ 200	₹ 10	₹	₹ 230	₹
2	₹	₹ 200	₹ 1800	₹ 1900	₹
3	₹ 1700	₹ 170	₹	₹ 1750	₹
4	₹ 180	₹	₹ 200	₹ 190	₹
5	₹	₹ 200	₹	₹ 2400	ખોટ	₹ 200

2. ₹ 8000માં ખરીદેલું જૂનું ફીઝ રિપોર્ટ કરાવવાનો ખર્ચ ₹ 1100 થયો. આ ફીઝ ₹ 8500માં વેચતાં નફો થાય કે ખોટ ? કેટલા રૂપિયા ?
3. ₹ 2800માં ખરીદેલો મોબાઇલ ફોન રિપોર્ટ કરાવવાનો ખર્ચ ₹ 150 થયો. આ મોબાઇલ ફોન ₹ 3100માં વેચતાં કેટલા રૂપિયા નફો થાય ?

સ્વાધ્યાય

1. સચિને કરેલા વેપારની વિગત નીચે મુજબ છે. આ આધારે સચિનને કેટલા રૂપિયા નફો કે ખોટ થશે તે ગણો :

ખરીદી	વેચાણ	કુલ રૂપિયા
₹ 1700 વોટરબોગ નંગ 10	₹ 220 લેખે 1 વોટરબોગ	₹
₹ 50 રિક્ષાભાડું	₹ 190 લેખે 1 વોટરબોગ	₹
	₹ 195 લેખે 3 વોટરબોગ	₹
	₹ 180 લેખે 2 વોટરબોગ	₹
	₹ 160 લેખે 3 વોટરબોગ	₹

2. એક ફેરિયાએ ₹ 1050માં સરખા ભાવનાં 10 શર્ટ ખરીદાં. આ બધાં શર્ટ તેણે નીચે આપેલ કિંમત મુજબ વેચી દીધાં. હવે આપેલ પ્રશ્નોના જવાબ લખો :



- (1) 1 શર્ટની ખરીદકિમત કેટલી છે ?
- (2) ફેરિયાને જે શર્ટ વેચતાં ₹ 20થી વધુ નફો મળ્યો, તે શર્ટમાં કેસરી રંગ પૂરો.
- (3) ફેરિયાને જે શર્ટ વેચતાં 10થી 20 રૂપિયા સુધી નફો મળ્યો, તે બધાં શર્ટમાં પીળો રંગ પૂરો.
- (4) ફેરિયાને જે શર્ટ વેચતાં ₹ 10થી ઓછો નફો મળ્યો, તે શર્ટમાં લીલો રંગ પૂરો.
- (5) ફેરિયાને જે શર્ટ વેચતાં ખોટ થઈ, તે શર્ટમાં ભૂરો રંગ પૂરો.
- (6) બધાં જ શર્ટ વેચતાં ફેરિયાને નફો થાય કે ખોટ જાય ? કેટલા રૂપિયા ?
- (7) ફેરિયાને જે શર્ટ વેચતાં નફો કે ખોટ થઈ હોય, તે શર્ટમાં ગુલાબી રંગ કરો.



મહાવરો 1

- 1.** (1) ખ. ક્ર. = ₹ 5, વેક્ટ = ₹ 6 (2) ખ. ક્ર = ₹ 70, વેક્ટ = ₹ 80
 (3) ખ. ક્ર. = ₹ 350, વેક્ટ = ₹ 450 (4) ખ. ક્ર. = ₹ 680, વેક્ટ = ₹ 640
- 2.** (1) નફો થાય, 3 રૂપિયા (2) નફો થાય, 2 રૂપિયા (3) નફો થાય, 3 રૂપિયા
 (4) નફો થાય, 6 રૂપિયા (5) નફો થાય, 6 રૂપિયા (6) ખોટ જાય, 2 રૂપિયા
 (7) નફો થાય, 10 રૂપિયા (8) ખોટ જાય, 5 રૂપિયા

મહાવરો 2

1. (1) પ. ક્ર. = ₹ 210, નફો = ₹ 20

(2) ખ. ક્ર. = ₹ 1600, નફો = ₹ 100

(3) પ. ક્ર. = ₹ 1870, ખોટ = ₹ 120

(4) ખરાજત = ₹ 20, ખોટ = ₹ 10

(5) ખ. ક્ર. = ₹ 2400, પ. ક્ર. = ₹ 2600

2. ખોટ થાય, ₹ 600

3. નફો થાય, ₹ 150

સ્વાધ્યાય

1. (1) નફો ₹ 85

2. (1) ₹ 105 (6) નફો ₹ 105




13

અણાત સંખ્યા (Unknown Numbers)

- એશા અને કિશ રમત રમી રહ્યા છે. જરૂર પડે ત્યાં તમે મદદ કરો અને અધૂરો સંવાદ પૂર્ણ કરો.

એશા : (કાચની પેટી બતાવે છે.) જો,
પેટીમાં કેટલા દડા છે ?

કિશ : આ પેટીમાં 9 દડા છે.



એશા : કેટલી ચોકલેટ હશે? વિચાર, તો!

કિશ :
.....

એશા : ચોકલેટની થેલીમાં કેટલી ચોકલેટ
છે, તે ચોક્કસપણે કહી શકાય છે?
ના.




- જે સંખ્યાઓને આપણે જાણીએ છીએ, તેવી સંખ્યાઓને જ્ઞાત સંખ્યાઓ કહે છે.
જેમકે, 5, 6, 9,... વગેરે.
- જે સંખ્યા વિશે ચોક્કસ જવાબ આપી શકતો નથી, તેવી સંખ્યાને અજ્ઞાત સંખ્યા કહે છે.

- એશા અને કિશ હવે દીવાસળી લાવે છે અને તેના વડે રમત રમવાનું નક્કી કરે છે. તેઓ તેના વડે અંગ્રેજ મૂળાક્ષરો બનાવવાનું નક્કી કરે છે.
- એશા દીવાસળી લઈને અંગ્રેજ મૂળાક્ષર L બનાવે છે.



- ત્યાર બાદ કિશ પણ બે દીવાસળી લઈને એશાએ બનાવેલા Lની બાજુમાં જ બીજો L બનાવે છે.



- આ રીતે તેઓ ત્રણ L બનાવે છે.



તેઓ આ રમત રમતાં હોય છે, તેવામાં જ તેમનો મિત્ર અમન આવે છે.

અમન : જો, આવા 8L બનાવવા હોય, તો કેટલી દીવાસળી જોઈએ ?

એશા : દીવાસળીની સંખ્યા જાણવા આ રીતે ગણતરી કરીશું :

$$\text{L બનાવવા જરૂરી દીવાસળીની સંખ્યા} = 2 \times \text{Lની સંખ્યા}$$

$$\therefore 8\text{L બનાવવા જરૂરી દીવાસળીની સંખ્યા} = 2 \times 8 = 16$$

$$\therefore 8\text{L બનાવવા} 16 \text{ દીવાસળી જોઈએ.}$$

કિશ : જો બનાવવા માંગતા Lની સંખ્યા આપણે જાણતા ન હોઈએ, એટલેકે અમુક સંખ્યામાં L બનાવવા હોય, ત્યારે કેવી રીતે ગણતરી કરીશું ?

એશા : જ્યારે અમુક સંખ્યામાં L બનાવવા માંગતા હોઈએ ત્યારે, Lની સંખ્યા માટે n ધારીએ. આમ, આપણા માટે n એ અણાત સંખ્યા છે.

અમુક L બનાવવા જરૂરી દીવાસળીની સંખ્યા = $2 \times n = 2n$

અહીં $n = 1, 2, 3, 4, \dots$ કિમત લેતાં અનુક્રમે 1L, 2L, 3L, 4L, ... મુજબ દીવાસળીની સંખ્યા જાડી શકાશે.

હવે, તેઓ દીવાસળીમાંથી નીચે મુજબ E બનાવે છે:




બનાવેલ E ની સંખ્યા	1	2	3	4	5	6	7	...	x
દીવાસળીની સંખ્યા	5	10						...	5x

અહીં $5x$ માં x એ અજ્ઞાત સંખ્યા છે.

$x = 1, 2, 3, 4, \dots$ વગેરે સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા x ના મૂલ્ય તરીકે હોઈ શકે.

અજ્ઞાત સંખ્યાઓ દર્શાવવા માટે a, b, c, \dots, x, y, z જેવા અંગ્રેજ મૂળાક્ષરો વાપરવામાં આવે છે.



એશા અને કિશ બુકસ્ટોરમાં જાય છે. આ બુકસ્ટોરમાં સ્વાધ્યાયપોથીની કિમત ₹ 25, પેનની કિમત ₹ 2 અને કંપાસપેટીની કિમત ₹ 20 છે.

(1) એશાને 10 પેન ખરીદવા કેટલા રૂપિયા જોઈએ ?

(2) x પેન ખરીદવા કેટલા રૂપિયા જોઈએ ?

(3) m નંગ સ્વાધ્યાયપોથી ખરીદવા કેટલા રૂપિયા જોઈએ ? _____

(4) y નંગ કંપાસપેટી ખરીદવા કેટલા રૂપિયા જોઈએ ? _____

આપણે જેટલાં ઉદાહરણો જોયાં, તેમાં અજ્ઞાત સંખ્યાનો એટલેકે a, b, c, \dots, x, y, z નો કોઈ સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે. જેમકે, $2 \times x = 2x, 25 \times m = 25m, 25 \times y = 20y$ વગેરે. પરંતુ દરેક પરિસ્થિતિમાં આવું ના હોઈ શકે. કોઈ વખત અજ્ઞાત સંખ્યા સાથે સરવાળા કે બાદબાકી પણ કરવા પડે. જેમકે,

(1) કવિતા કહે છે, મારી પાસે નિલમ કરતાં 10 લખોટી વધારે છે.

એટલેકે, જો નિલમ પાસે 5 લખોટી હોય, તો કવિતા પાસે 15 લખોટી હશે. જો નિલમ પાસે 25 લખોટી હોય, તો કવિતા પાસે 35 લખોટી હશે.

તેથી કવિતા પાસેની લખોટી = નિલમ પાસેની લખોટી + 10

જો નિલમ પાસે કેટલી લખોટી છે તે આપણે ન જાણતા હોઈએ, તો નિલમ પાસેની લખોટીને x વડે દર્શાવી શકીએ.

$$\therefore \text{કવિતા પાસેની લખોટી} = x + 10$$

વિચારો ! • જો $x = 8$ હોય, તો કવિતા પાસે કેટલી લખોટી હશે ? _____

• જો $x = 8$ હોય, તો નિલમ પાસે કેટલી લખોટી હશે ? _____

(2) મહેશ અને નરેશ બે ભાઈઓ છે. મહેશ નરેશને કહે છે તું મારાથી 4 વર્ષ નાનો છે.

એટલેકે, જો મહેશની ઉંમર 10 વર્ષ હોય, તો નરેશની ઉંમર $10 - 4 = 6$ વર્ષ થાય. જો મહેશની ઉંમર 15 વર્ષ હોય, તો નરેશની ઉંમર 11 વર્ષ થાય.

જો મહેશની હાલની ઉંમર આપણને ખબર ન હોય, તો મહેશની ઉંમર માટે y મૂલ્ય લઈ શકીએ.

$$\therefore \text{નરેશની ઉંમર} = \text{મહેશની ઉંમર} - 4 = y - 4$$

વિચારો ! • મહેશની ઉંમર 22 વર્ષ હોય, તો નરેશની ઉંમર કેટલી હોય ? _____

• જો $y = 8$ હોય, તો મહેશની ઉંમર કેટલી હોય ? _____

• જો $y = 13$ હોય, તો નરેશની ઉંમર કેટલી હોય ? _____

મહાવરો 1

1. ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :



- (1) ઢીંગલીની કિમત કરતાં બોટની કિમત ₹ 50 વધારે છે, તો બોટની કિમત કેટલી થાય ?
- (2) ઢીંગલીની કિમત કરતાં પાણીની બોટલની કિમત ₹ 15 ઓછી છે, તો પાણીની બોટલની કિમત કેટલી થાય ?
- (3) ઢીંગલીની કિમત કરતાં નોટબુકની કિમત ₹ 20 ઓછી છે, તો નોટબુકની કિમત કેટલી થાય ?
2. એક પેટીમાં 35 સફરજન છે, તો આવી m પેટીમાં કેટલાં સફરજન હશે ?
3. કિજલ અને પિંકી બંને બહેનો છે. પિંકી કિજલને કહે છે, તું મારા કરતાં બે વર્ષ મોટી છે. જો પિંકીની ઉંમર 12 વર્ષ હોય, તો કિજલની ઉંમર કેટલી થાય ?
4. નયન અને ભાર્ગવ બંને ભિત્રો છે. ભાર્ગવ પાસે નયન કરતાં બમણી ચોકલેટ છે, તો ભાર્ગવ પાસે કેટલી ચોકલેટ હશે ? (ચોકલેટ માટે અજ્ઞાત સંખ્યા તરીકે d વાપરો.)
5. રોશની પોતાની પાસેનાં 45 મોતીમાંથી અમુક મોતી રજિયાને આપે છે, તો રોશની પાસે કેટલાં મોતી વધે ? (અજ્ઞાત સંખ્યા તરીકે x વાપરો.)
6. પાડુલ પાસેના રૂપિયામાં 50 રૂપિયા ઉમેરવામાં આવે તો, ઈલા પાસેના રૂપિયા મળે છે, તો ઈલા પાસે કેટલાં રૂપિયા હશે ? (અજ્ઞાત સંખ્યા તરીકે r વાપરો.)

- સાંકેતિક સ્વરૂપ :
- જુઓ અને સમજો :

$$3\text{નાં બમણાં} = 2 \times 3$$

$$4\text{નાં ત્રણ ગણાં} = 3 \times 4$$

$$10\text{નાં ચાર ગણાં} = 4 \times 10$$

$$9\text{ના અડધા} = 9 \div 2 = \frac{9}{2}$$

$$10\text{નો ત્રીજો ભાગ} = 10 \div 3 = \frac{10}{3}$$

$$6\text{નો ચોથો ભાગ} = 6 \div 4 = \frac{6}{4}$$

$$x\text{ના બમણાં} = 2 \times x = 2x$$

$$y\text{નાં ત્રણ ગણાં} = 3 \times y = 3y$$

$$b\text{નાં છ ગણાં} = 6 \times b = 6b$$

$$p\text{ના અડધા} = p \div 2 = \frac{p}{2}$$

$$m\text{નો પાંચમો ભાગ} = m \div 5 = \frac{m}{5}$$

$$n\text{નો આઠમો ભાગ} = n \div 8 = \frac{n}{8}$$

- હવે, નીચે આપેલી બાબતોને સાંકેતિક સ્વરૂપે લખતાં શીખીએ :

ક્રમ	ગાણિતિક બાબત	સાંકેતિક સ્વરૂપ
1	x માં 4 ઉમેરતાં 29 થાય છે.	$x + 4 = 29$
2	n નાં ત્રણ ગણાંમાં 5 ઉમેરતાં	$3 \times n + 5 = 3n + 5$
3	4ને y વડે ભાગતાં	$4 \div y = \frac{4}{y}$
4	m ને 8 વડે ભાગી, તેમાંથી 9 બાદ કરતાં	$m \div 8 - 9 = \frac{m}{8} - 9$

ઉદાહરણ 1 : અમુક સંખ્યાનાં દસ ગણાંમાં 15 ઉમેરતાં 20 થાય છે.

ઉકેલ : અહીં અમુક સંખ્યા જાણતા નથી. ધારોકે અમુક સંખ્યા a છે.

$\therefore a$ નાં દસ ગણાંમાં 15 ઉમેરતાં 20 થાય છે.

$\therefore a \times 10 + 15 = 20$

$\therefore 10a + 15 = 20$

અહીં $10a + 15 = 20$ એ ઉપરના ગાણિતિક વિધાનનું સાંકેતિક સ્વરૂપ છે.

ઉદાહરણ 2 : કપિલા જિગીષાને કહે છે, તારી ઉંમર મારા કરતાં અડધી છે. જો કપિલાની ઉંમર x વર્ષ હોય, તો જિગીષાની ઉંમર કેટલી થાય ?

ઉકેલ : જિગીષાની ઉંમર કપિલા કરતાં અડધી છે.

\therefore જિગીષાની ઉંમર $=$ કપિલાની ઉંમર $\div 2 = x \div 2 = \frac{x}{2}$

\therefore જિગીષાની ઉંમર $\frac{x}{2}$ વર્ષ થાય.

સ્વાધ્યાય

1. નીચેની ગણિતિક બાબતોને સંકેતિક સ્વરૂપમાં લખો :

- (1) x માં 10 ઉમેરતાં.
- (2) અમુક દડામાંથી 15 દડા તૂટી જાય, તો 20 દડા વધે.
- (3) ટોપલીમાંનાં m ટામેટાંમાંથી 16 ટામેટાંનું શાક બનાવતાં 12 વધે છે.
- (4) n માં 7 ઉમેરી, તેને 2 વડે ભાગતાં
- (5) p નાં ત્રણ ગણાંમાં 4 ઉમેરતાં
- (6) 5માંથી a બાદ કરતાં 4 ભણે છે.
- (7) 25માંથી અમુક સંખ્યાનો દસમો ભાગ બાદ કરતાં
- (8) b માંથી 7 બાદ કરી તેનાં પાંચ ગણાં કરતાં
- (9) રહીમ પાસે d લખોટી છે. તેનો ભાઈ તેને 9 લખોટી આપે, તો તેની પાસે 27 લખોટી થાય.
- (10) રનાં ચાર ગણાંમાંથી 10 બાદ કરતાં 10 વધે છે.
- (11) એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં ત્રણ ગણી છે, તો તેની લંબાઈ કેટલી થાય ? (અજ્ઞાત સંખ્યા તરીકે y વાપરો.)
- (12) એક લંબઘનની લંબાઈ તેની પહોળાઈ કરતાં બમણી છે, જ્યારે તેની ઊંચાઈ લંબાઈના ત્રીજા ભાગ કરતાં 4 વધારે છે. જો પહોળાઈ y મીટર હોય, તો લંબાઈ અને ઊંચાઈ શોધો.

વિચારો : આ સાલાખંડમાં કેટલી વ્યક્તિ હશે ?



2. રામની હાલની ઉંમર y વર્ષ કેટને નીચેના પ્રશ્નોના જવાબ આપો :

- (1) આજથી પાંચ વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે ?
- (2) ત્રણ વર્ષ પહેલાં રામની ઉંમર કેટલી હશે ?
- (3) તેના દાદાની ઉંમર તેની ઉંમર કરતાં છ ગણી છે, તો તેના દાદાની ઉંમર કેટલી ?
- (4) તેની દાદીની ઉંમર તેના દાદાની ઉંમર કરતાં બે વર્ષ ઓછી છે, તો તેની દાદીની ઉંમર કેટલી હશે ?
- (5) તેના પિતાની ઉંમર તેની ઉંમરનાં ત્રણ ગણાં કરતાં પાંચ વર્ષ વધારે છે, તો તેના પિતાની ઉંમર કેટલી હશે ?



મહાવરો 1


1. (1) બોટની કિંમત = ઢોંગલીની કિંમત + ₹ 50
 (2) પાણીની બોટલની કિંમત = ઢોંગલીની કિંમત - ₹ 15
 (3) નોટબુકની કિંમત = ઢોંગલીની કિંમત - ₹ 20
2. સફરજનની સંખ્યા = 35 m 3. કિજલની ઉંમર = 14 વર્ષ 4. $2d$
5. $45 - x$ 6. $z + 50$

સ્વાધ્યાય


1. (1) $x + 10$ (2) $x - 15 = 20$ (3) $m - 16 = 12$ (4) $\frac{n+7}{2}$ (5) $3p + 4$
 (6) $5 - a = 4$ (7) $25 - \frac{x}{10}$ (8) $5(b - 7)$ (9) $d + 9 = 27$
 (10) $4z - 10 = 10$ (11) $3y$ (12) લંબાઈ = $2y$; ઊંચાઈ = $\frac{2y}{3} + 4$
2. (1) $y + 5$ (2) $y - 3$ (3) $6y$ (4) $6y - 2$ (5) $3y + 5$

આલો યાદ કરીએ...


- નીચે આપેલ ત્રિકોણની બાજુઓને માપો અને તે પરથી ત્રિકોણના પ્રકારને ઓળખો :

 $AB = \dots\dots$ સેમી $BC = \dots\dots$ સેમી $CA = \dots\dots$ સેમી

આમ, જે ત્રિકોણની ત્રણેય બાજુઓનાં માપ સરખાં હોય, તેને સમબાજુ ત્રિકોણ કહેવાય.


 $PQ = \dots\dots$ સેમી $PR = \dots\dots$ સેમી $QR = \dots\dots$ સેમી

આમ, જે ત્રિકોણની બે બાજુઓનાં માપ સરખાં હોય, તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય.

 $XY = \dots\dots$ સેમી $YZ = \dots\dots$ સેમી $XZ = \dots\dots$ સેમી

આમ, જે ત્રિકોણની ત્રણેય બાજુઓનાં માપ અલગ-અલગ હોય, તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય, અથવા જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનાં માપ સરખાં ન હોય, તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય.


1. નીચે આપેલા ત્રિકોણના ખૂણા માપી નીચેના કોષ્ટકમાં લખો તથા સરવાળો કરો :



ΔABC	માપ $\angle A$	માપ $\angle B$	માપ $\angle C$	માપ $\angle A +$ માપ $\angle B +$ માપ $\angle C$
1				
2				
3				


પ્રવૃત્તિ :

સૌપ્રથમ કાગળમાંથી ત્રિકોણ કાપો.
ત્રિકોણના ત્રણેય ખૂણામાં આકૃતિમાં બતાવ્યા
પ્રમાણે અલગ-અલગ રંગ પૂરો. હવે તમે
રંગેલા ત્રિકોણના ત્રણેય ખૂણા કાતરની મદદથી
કાપો.



ત્રણેય ખૂણાઓને નીચેની આકૃતિમાં
દર્શાવ્યા મુજબ ગોઠવો.

આમ, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો
 180° થાય.




- ત્રિકોણના ખૂણાનાં માપ આધારિત કોયડા :

ઉદાહરણ 1 : નીચે આપેલ ΔAOB ના ખૂણાઓને કોણમાપકથી માપી, તેનો સરવાળો કરો.

ઉકેલ : માપ $\angle A = 45^\circ$, માપ $\angle O = 80^\circ$ તથા માપ $\angle B = 55^\circ$ થાય છે.

$$\begin{aligned} \text{તેથી, } & \text{માપ } \angle A + \text{માપ } \angle O + \text{માપ } \angle B \\ & = 45^\circ + 80^\circ + 55^\circ \\ & = 180^\circ \end{aligned}$$



ઉદાહરણ 2 : ત્રિકોણના એક ખૂણાનું માપ 70° અને બીજા ખૂણાનું માપ 40° હોય, તો ત્રીજા ખૂણાનું માપ શોધો.

ઉકેલ : ત્રિકોણના બે ખૂણાઓનાં માપ 70° અને 40° છે.

ત્રિકોણના ત્રણેય ખૂણાઓનાં માપનો સરવાળો 180° થાય છે.

ત્રિકોણના બે ખૂણાઓનાં માપ આપેલાં છે. તેમનો સરવાળો કરતાં

$$\begin{aligned} & = 70^\circ + 40^\circ \\ & = 110^\circ \end{aligned}$$

તેથી, ત્રીજા ખૂણાનું માપ = $180^\circ - 110^\circ = 70^\circ$

ઉદાહરણ 3 : ΔABC માં માપ $\angle A = 65^\circ$ તથા માપ $\angle B = 55^\circ$, તો માપ $\angle C$ શોધો.

ઉકેલ : ΔABC માં માપ $\angle A = 65^\circ$ તથા માપ $\angle B = 55^\circ$

$$\begin{aligned} \text{માપ } \angle A \text{ અને માપ } \angle B \text{ નો સરવાળો} & = 65^\circ + 55^\circ \\ & = 120^\circ \end{aligned}$$

ત्रिकोणના ત્રણેય ખૂશાઓનાં માપનો સરવાળો 180° થાય છે.

$$\text{તેથી માપ } \angle C = 180^\circ - 120^\circ$$

$$= 60^\circ$$

ઉદાહરણ 4 : ત્રિકોણના એક ખૂશાનું માપ 90° છે અને બાકીના બે ખૂશાઓનાં માપ સરખાં છે, તો તે ખૂશાઓનાં માપ શોધો.

ઉકેલ : ત્રિકોણના એક ખૂશાનું માપ 90° છે.

બાકીના બે ખૂશાઓનાં માપ સરખાં છે.

$$\begin{aligned} \text{બે સરખાં માપના ખૂશાઓનાં માપનો સરવાળો} &= 180^\circ - 90^\circ \\ &= 90^\circ \end{aligned}$$

બે સરખાં માપના ખૂશાઓનો માપનો સરવાળો 90° થાય છે.

$$\text{એક ખૂશાનું માપ} = \frac{90}{2} = 45^\circ, \text{ તેથી બંને સરખા ખૂશાનું માપ} 45^\circ \text{ છે.}$$

મહાવરો 1

1. નીચે આપેલા ત્રિકોણના દરેક ખૂશાઓનું માપ કોણમાપકની મદદથી માપીને વિગતો પૂર્ણ કરો :

$$(1) \text{ માપ } \angle A = \dots\dots$$


$$\text{માપ } \angle B = \dots\dots$$

$$\text{માપ } \angle C = \dots\dots$$

$$\text{માપ } \angle A + \text{માપ } \angle B + \text{માપ } \angle C$$

$$= \dots\dots + \dots\dots + \dots\dots$$

$$= \dots\dots$$



$$(2) \text{ માપ } \angle P = \dots\dots$$


$$\text{માપ } \angle Q = \dots\dots$$


$$\text{માપ } \angle R = \dots\dots$$

$$\text{માપ } \angle P + \text{માપ } \angle Q + \text{માપ } \angle R$$

$$= \dots\dots + \dots\dots + \dots\dots$$

$$= \dots\dots$$



(3) માપ $\angle X = \dots\dots$ માપ $\angle Y = \dots\dots$ માપ $\angle Z = \dots\dots$ માપ $\angle X +$ માપ $\angle Y +$ માપ $\angle Z$ $= \dots\dots + \dots\dots + \dots\dots$ $= \dots\dots$ 

2. ત્રિકોણના એક ખૂણાનું માપ 62° અને બીજા ખૂણાનું માપ 58° હોય, તો ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધો.
3. ત્રિકોણના બે ખૂણાનાં માપ સરખાં છે. આ દરેક ખૂણાનું માપ 40° હોય, તો ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધો.
4. કાટકોણ ΔABC માં માપ $\angle A = 35^\circ$ છે, તો બાકીના ખૂણાનું માપ શું થાય ?
5. એક ત્રિકોણના ત્રણેય ખૂણાનાં માપ સરખાં છે, તો ત્રિકોણના દરેક ખૂણાનું માપ જણાવો.

સ્વાધ્યાય

1. નીચે ત્રિકોણના બે ખૂણાઓનાં માપ આપેલાં છે. તેના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી, ત્રીજા ખૂણાનું માપ ખાલી જગ્યામાં લખો :

(1) $62^\circ, 88^\circ, \dots\dots$	$(62^\circ, 35^\circ, 30^\circ)$
(2) $77^\circ, 48^\circ, \dots\dots$	$(45^\circ, 55^\circ, 65^\circ)$
(3) $90^\circ, 30^\circ, \dots\dots$	$(06^\circ, 36^\circ, 60^\circ)$
(4) $60^\circ, 60^\circ, \dots\dots$	$(60^\circ, 90^\circ, 120^\circ)$
(5) $12^\circ, 32^\circ, \dots\dots$	$(163^\circ, 136^\circ, 44^\circ)$
2. ત્રિકોણના બે ખૂણાઓનાં માપ અનુક્રમે 110° અને 65° છે, તો ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધો.
3. ત્રિકોણના બે ખૂણાઓનાં માપ સરખાં છે. સરખા માપના દરેક ખૂણાનું માપ 45° હોય, તો ત્રીજા ખૂણાનું માપ શોધો.

4. એક ત્રિકોણના બે ખૂણાઓનાં માપ સરખાં છે. ત્રીજા ખૂણાનું માપ 120° છે, તો સરખાં માપના ખૂણાઓનું માપ શોધો.
5. $\triangle ABC$ માં માપ $\angle A = 35^\circ$ તથા માપ $\angle B = 65^\circ$, તો માપ $\angle C$ શોધો.



મહાવરો 1

2. 60° 3. 100° 4. 55° 5. 60°

સ્વાધ્યાય

1. (1) 30° (2) 55° (3) 60° (4) 60° (5) 136°
 2. 5° 3. 90° 4. 30° 5. 80°



જ્ઞાન કરીએ :

પ્રવૃત્તિ:

સૌપ્રથમ આકૃતિ 1(a)માં દર્શાવ્યા પ્રમાણે એક ચોરસ કાગળ લો. તેને આકૃતિ 1(b)માં દર્શાવ્યા પ્રમાણે અડધો વાળો. ત્યારબાદ ફરી એક વાર આકૃતિ 1(c)માં દર્શાવ્યા પ્રમાણે વાળો. છેલ્લે વાળેલ ભાગને આકૃતિ 1(d) પ્રમાણે ખોલી એક ખૂણાથી આકૃતિ 1(e)માં દર્શાવ્યા પ્રમાણે વાળો અને બરાબર ગડીનાં નિશાન બનાવી કાગળ ખોલો. આ ખૂણાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનાં નામ આપો.

હવે તમે જોઈ શકશો કે, જે ગડી બની છે, તેમાં તમામ પ્રકારના ખૂણા બને છે.




ચાલો, કોણમાપકની મદદથી માપી આ ખૂણાને ઓળખી બતાવો.

આકૃતિ 1(a)	આકૃતિ 1(b)	આકૃતિ 1(c)	આકૃતિ 1(d)	આકૃતિ 1(e)	આકૃતિ 1(f)

આકૃતિ 1(f) ને આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપો :

- આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને છે ? કયા-કયા ?
- લઘુકોણનું માપ કેટલું છે ?
- કેટલા ખૂણા કાટકોણ છે ? કયા-કયા ?
- કયા-કયા ખૂણા ગુરુકોણ છે ? તેનું માપ જણાવો.

હવે આપેલ ચિત્રોનો અભ્યાસ કરો :



આપેલ ચિત્રોમાં ખૂલાઓ દર્શાવેલ છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો :

- લઘુકોણ ક્યા-ક્યા ચિત્રમાં બતાવેલ છે ?
- ગુરુકોણ ક્યા-ક્યા ચિત્રમાં બતાવેલ છે ?
- કાટકોણ ક્યા-ક્યા ચિત્રમાં બતાવેલ છે ?

ઉપરની આકૃતિમાં દર્શાવેલ વસ્તુઓમાં ખૂલાનો નિર્દેશ થાય છે. તેના આધારે તમારી આસપાસ રહેલી કઈ-કઈ વસ્તુઓમાં ખૂલાનો નિર્દેશ થાય છે, તે નીચેના કોષ્ટકમાં લખો :

વસ્તુનું નામ	ક્યો ખૂલો દર્શાવે છે ?

આપેલ ઘડિયાળના ચિત્રમાં કાંટા દ્વારા બનતા ખૂશાઓનો અભ્યાસ કરો.

દર્શાવેલ ઘડિયાળમાં કલાક અને મિનિટ-કાંટા વડે ખૂશાઓ રચાય છે. તેને

કોણમાપકથી માપો અને તેને આધારે પ્રકાર નક્કી કરો :

માપ પ્રકાર	માપ પ્રકાર	માપ પ્રકાર


• નવું શીખીએ :



આપેલ વર્તુળને ધ્યાનથી જુઓ. તેમાં ચાર ખૂશા કાટખૂશા છે.

$$\text{એટલેકે } 4 \times 90^\circ = 360^\circ$$

આમ, વર્તુળના કેન્દ્ર આગળ બનતા તમામ ખૂશાઓના માપનો સરવાળો 360° થાય.



ઘડિયાળના ચંદાને વર્તુળ ગણી તેના 12 સરખા ભાગ પાડીએ, તો દરેક ભાગથી કેન્દ્ર

$$\text{આગળ બનતા ખૂશાનું માપ} = \frac{360^\circ}{12} = 30^\circ$$

આમ, ઘડિયાળના કંટા 1 અને 2 વચ્ચે કે 2 અને 3 વચ્ચે 30° નો ખૂણો બનાવે.



દર્શાવેલ ઘડિયાળ જુઓ.

કલાક-કંટો 3 અને મિનિટ-કંટો 12 પર છે.


બંને કંટા વચ્ચે 30° માપના ત્રણ ભાગ બને છે.

$$30^\circ \times 3 = 90^\circ$$


મહાવરો 1

1. આપેલ ઘડિયાળના કંટા વડે કયા માપનો ખૂણો બને છે, તે નીચે બોક્સમાં લખો :

(1)



(2)



(3)



(4)



2. દર્શાવેલ સમયે કેવા પ્રકારનો ખૂણો બનાવશો, તે લખો :

(લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ)


(a) 3:20 =

(b) 10:55 =


(c) 11:25 =

(d) 3:00 =

કોણમાપકની ઉપયોગિતા :



કોણમાપકની મદદથી ખૂશાનું માપન




કોણમાપકની મદદથી ખૂશાની રચના :

ઉદાહરણ : 40° ના ખૂશાની રચના કરવી.


પગલું 1 :

\overrightarrow{OA} દોરો.



પગલું 2 :

\overrightarrow{OA} પર કોણમાપક એવી રીતે રાખો,
જેથી \overrightarrow{OA} નું ઉગમબિંદુ કોણમાપકના
બરાબર વચ્ચેના બિંદુ પર આવે.




પગલું 3 :

કોણમાપકની નીચેની રેખા \overrightarrow{OA} પર
બરાબર ગોઠવો.

પગલું 4 :


\overrightarrow{OA} પર કોણમાપકના જમણી બાજુના
 0° થી શરૂ કરી જ્યાં 40° થાય, ત્યાં
બિંદુ B દર્શાવો. પછી કોણમાપક ઉપાડી
લો.



પગલું 5 :

\overrightarrow{OB} ની રચના કરો.

આમ, $\angle AOB = 40^\circ$ ના માપનો થશે.




ઉદાહરણ 1 : માપ $\angle XYZ = 120^\circ$ ના ખૂલાની રચના કરવી.

પગલું 1 : \overrightarrow{YZ} દોરો.

પગલું 2 : \overrightarrow{YZ} પર કોણમાપક એવી રીતે રાખો, જેથી \overrightarrow{YZ} નું ઊગમબિંદુ કોણમાપકના બરાબર વચ્ચેના બિંદુ પર આવે.

પગલું 3 : કોણમાપકની નીચેની રેખા \overrightarrow{YZ} પર બરાબર ગોઠવો.




પગલું 4 : \overrightarrow{YZ} પર કોણમાપકના ડાખી બાજુના 0° થી શરૂ કરીને, જ્યાં 120° થાય, ત્યાં બિંદુ X દોરો.

પગલું 5 : \overrightarrow{YX} ની રચના કરો. આમ, $\angle XYZ = 120^\circ$ ના માપનો થશે.

યાદ રાખો :

ભુજની લંબાઈથી ખૂલાના માપમાં

કોઈ ફેરફાર થતો નથી.




મહાવરો 2

1. કોણમાપકની મદદથી નીચેના ખૂબાની રચના કરો :

- | | |
|----------------------------------|---------------------------------|
| (1) માપ $\angle PQR = 145^\circ$ | (4) માપ $\angle MNO = 90^\circ$ |
| (2) માપ $\angle XYZ = 60^\circ$ | (5) માપ $\angle O = 35^\circ$ |
| (3) માપ $\angle ABC = 20^\circ$ | (6) માપ $\angle I = 170^\circ$ |

સ્વાધ્યાય

1. ઘડિયાળની નીચે આપેલ અંશનો ખૂબો ઘડિયાળમાં દર્શાવો :



2. કોણમાપકની મદદથી આપેલ માપના ખૂબાની રચના કરો :

- (a) માપ $\angle ABC = 155^\circ$ (b) માપ $\angle P = 80^\circ$ (c) માપ $\angle Z = 105^\circ$

આટલું ધ્યાનમાં રાખીએ : માપ $\angle PQR = 120^\circ$ ને $m\angle PQR = 120^\circ$ પણ લખી શકાય.



જવાબ

મહાવરો 1

- (1) 60° (2) 150° (3) 30° (4) 120°
- (a) લઘુકોણ (b) લઘુકોણ (c) ગુરુકોણ (d) કાટકોણ

પુનરાવર્તન : 4 (Revision : 4)

1. કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરો :

- (1) 584×18 (2) 720×20 (3) 912×232
(4) $524 \div 4$ (5) $630 \div 6$

2. સરાસરી શોધો :

- (1) 36, 40, 46, 50 (2) 1326, 5940, 2430, 1100, 1029
(3) 328, 244, 523, 192, 483

3. 7 સેમી માપના વ્યાસના આધારે પરિકરની મદદથી વર્તુળ દોરો.

4. નીચેના દાખલા ગણો :

- (1) ₹ 167માં ખરીદેલ ઘડિયાળ ₹ 180માં વેચતાં કેટલા રૂપિયા નક્કો કે ખોટ થાય ?
(2) ₹ 256માં ખરીદેલ 10 કંપાસપેટી વેચતાં વેપારીને ₹ 300 મળ્યા, તો તેને
કેટલા રૂપિયા નક્કો થયો ?
(3) ₹ 7000માં ખરીદેલ જૂનું વોંશિંગ મશીન રિપોર કરાવવાનો ખર્ચ ₹ 1150 થયો.
આ વોંશિંગ મશીન ₹ 7500માં વેચતાં કેટલા રૂપિયા નક્કો કે ખોટ થાય ?

5. નીચેના દાખલા ગણો :

- (1) ત્રિકોણના બે ખૂણાઓનાં માપ અનુક્રમે 100° અને 20° છે. ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધો.
(2) ΔXYZ માં $m\angle X = 55^\circ$ અને $m\angle Y = 55^\circ$ છે, તો $\angle Z$ નું માપ શોધો.
(3) ΔPQR માં $m\angle P = 35^\circ$ અને $m\angle Q = 55^\circ$ છે, તો $\angle R$ નું માપ શોધો.

6. ગણતરી કરો અને ખાનામાં યોગ્ય અપૂર્ણક લખો :

$\frac{19}{31}$	+		=	$\frac{26}{31}$	-		=	$\frac{17}{31}$
+		-		+		-		+
$\frac{4}{31}$	-		=		+	$\frac{2}{31}$	=	
=		=	=	=		=		=
	+		=	$\frac{27}{31}$	-		=	
-		-		-		-		-
	+		=		-	$\frac{4}{31}$	=	
=		=	=	=		=		=
$\frac{18}{31}$	+		=		-	$\frac{3}{31}$	=	$\frac{17}{31}$

7. કોણમાપકની મદદથી આપેલ માપના ખૂબાની રચના કરો :

- (1) 135° (2) 85° (3) 30°

8. સાચા વિકલ્પ સામે ✓ ની નિશાની કરો :

- (1) a નાં ચાર ગણામાં 3 ઉમેરતાં, તેનું સાંકેતિક સ્વરૂપ

- (a) $3a + 4$ (b) $4a + 3$ (c) $a + 7$ (d) $\frac{a}{4} + 3$

- (2) x માંથી 5 બાદ કરી તેનાં બમજાં કરતાં, તેનું સાંકેતિક સ્વરૂપ

- (a) $x - 10$ (b) $2x - 5$ (c) $2(x - 5)$ (d) $\frac{x}{2} - 10$

- (3) 9માંથી y બાદ કરતાં 4 મળે, તેનું સાંકેતિક સ્વરૂપ

- (a) $9 - y = 4$ (b) $4 - y = 9$ (c) $y - 4 = 9$ (d) $y - 9 = 4$

(4) મેધાની હાલની ઉંમર x વર્ષ છે. તેની હાલની ઉંમરમાં 7 ઉમેરતાં દક્ષાની ઉંમર મળે છે, તો દક્ષાની ઉંમર હશે.

- (a) $\frac{x}{7}$ (b) $7x$ (c) $x + 7$ (d) $x - 7$

(5) 'મુસ્તાક પાસેની x લખોટીઓના 4 સરખા ભાગ કરતાં' નું સાંકેતિક સ્વરૂપ ?

- (a) $\frac{4}{x}$ (b) $\frac{x}{4}$ (c) $x + 4$ (d) $4x$

(6) જિજ્ઞાશ અશરફને કહે છે, તારા કરતાં મારી પાસે 10 પેન વધુ છે. જો જિજ્ઞાશ પાસે b પેન હોય, તો અશરફ પાસે કેટલી પેન હશે ?

- (a) $b - 10$ (b) $10b$ (c) $\frac{b}{10}$ (d) $b + 10$

(7) 'કોઈ એક સંખ્યાને 11 વડે ભાગતાં ભાગફળ 5 મળે' નું સાંકેતિક સ્વરૂપ ?

- (a) $11x + 5$ (b) $x + 11 = 5$ (c) $\frac{x}{11} = 5$ (d) $\frac{11}{x} = 5$



1. (1) 10,512 (2) 14,400 (3) 2,11,584 (4) 131 (5) 105

2. (1) 43 (2) 2365 (3) 354

4. (1) ₹ 13 નશે (2) ₹ 44 નશે (3) ₹ 650 ખોટ

5. (1) 60° (2) 70° (3) 90°

8. (1) b (2) c (3) a (4) c (5) b (6) a (7) c

